



ચિંતન શ્રી સ્વામિનારાયણ

વર્ષ :- ૨, અંક :- ૧૧, તા. ૨૦-૫-૦૭

:: સંસ્થાપક ::

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી

આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ

:: અધ્યક્ષ ::

પ.પૂ. ૧૦૮ શ્રી

ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ

:: પ્રયોજક ::

પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

:: પ્રકાશક ::

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર વતી

કો. સ્વામી શ્રી વિરક્તસ્વરૂપદાસજી

:: તંત્રી ::

સાધુ દિવ્યસ્વરૂપદાસજી

:: સંપાદક ::

સ્વામી આનંદસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય)

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધારનું રજિસ્ટર્ડ મુખપત્ર ઈ.સ. ૨૦૦૫ના ઓક્ટોબર માસથી પ્રારંભાયેલું, દર માસની ૨૦ તારીખે પ્રકાશિત થતું, આપના સમગ્ર કુટુંબ -પરિવારમાં આનંદ અને સંસ્કારની સોરભ પ્રસરાવે અને જીવનનું અનેક ઘડતર કરતું સામયિક.

:: લવાજમના દર ::

પંચવાર્ષિક : રૂ. ૩૫૦/-

પચીસ વર્ષ લવાજમ : રૂ. ૭૫૦/-

પરદેશમાં લવાજમ : \$ 130 U.S.A.

: £ 100 U.K.

:: લવાજમઅંગે ગ્રાહક પત્રવ્યવહાર ::

‘ચિંતન કાર્યાલય’

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર

તા.જી. રાજકોટ - ૩૬૦૦૨૫ ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧

Visit us : www.chintansardhar.com

www.sardhar.org

E-mail : amrutdhara2003@yahoo.com

સ્વસ્વરૂપોની પ્રતિષ્ઠા કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ

સર્વાવતારી, સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે પોતાની હૈયાતીમાંજ પોતાના જ હસ્તકમળ દ્વારા સ્વયં સ્વસ્વરૂપોને પ્રતિષ્ઠિત કરતા ગયા હતા. કારણ કે પાછળથી તે તે સ્વરૂપો દ્વારા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તજનોની પૂજા, અર્ચના, ભક્તિ, ભાવનાને સ્વીકારતા રહે અને ભક્તજનોનું આત્મિક કલ્યાણ હંમેશાને માટે થતું રહે, આવા ઉદ્દેશથી શ્રીજી મહારાજે સ્વયં સ્વસ્વરૂપોને પ્રતિષ્ઠિત કર્યા હતા.

:: અનુક્રમણિકા ::

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિ પ્રતિષ્ઠા અને પૂજનવિધિ

૧ સાધુ અમૃતસ્વરૂપદાસ તથા સાધુ યોગેશ્વરદાસ - સરધાર ૦૬

પુરુષોત્તમ માસ - અધિક માસ માહાત્મ્ય

૨ સાધુ આનંદસ્વરૂપદાસજી તથા સાધુ અમૃતસ્વરૂપદાસ - સરધાર ૧૦

પશ્ચિમ પરસ્ત ભારતીયજનો !

૩ સાધુ યોગેશ્વરદાસ ગુરુ : પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ૧૪

વર્ણાશ્રમ ધર્મ

૪ મહેશ મહેતા (સુરત) ૧૭

ભગવદીયનો પક્ષ

૫ પાર્ષદ ખુશાલ ભગત ગુરુ : પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી ૧૮

હરિભક્તોને વર્તની રીતિ

૬ સાધુ આનંદસ્વરૂપદાસજી - સરધાર ૨ ૨૦

શ્રીજી મહારાજના નિષ્કામી સંગાથી... સદ્. મૂળજી બ્રહ્મચારી

૭ સાધુ અમૃતસ્વરૂપદાસ તથા ખુશાલ ભગત - સરધાર ૨૨

સત્સંગ સમાચાર પત્રિકા...

૮ અહેવાલ : સ્વામી ઘનશ્યામદાસજી - રઘુવીરવાડી-વડતાલ તથા સાધુ અમૃતસ્વરૂપદાસ - સરધાર ૨૪



મંદિરનો પ્રાણ એટલે પ્રતિષ્ઠિત મૂર્તિ. ઋષિઓએ વર્ષો પૂર્વે વિશ્વને જે અસાધારણ ભેટ આપી છે, તેમાંની એક છે મંદિર અને બીજી પ્રતિષ્ઠિત મૂર્તિ. અર્થાત્ સ્વરૂપ એટલે જ પ્રતિષ્ઠિત મૂર્તિ. મૂર્તિ એટલે ભગવાનનું પ્રતિક નહિ સાક્ષાત્ ભગવાન જ.

ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે પણ પોતાના પ્રિય જ્ઞાનીભક્ત ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે :

शैली दारुमयी लौही लेप्या लेख्या च सैकती ।

મનોમયી મણિમયી પ્રતિમાષ્ટવિધા સ્મૃતા ॥ (શ્રીમદ્ ભાગવત)

શીલાની, કાષ્ટની, ધાતુની, મૃતિકાની (ચંદનાદિકની), ચિત્રની, વેળુની (રેતીની), માનસિક અને મણિની એ પ્રમાણે આઠ પ્રકારની ભગવાનની પ્રતિમા કહેલી છે.

चलाचलेति द्विविधा प्रतिष्ठा जीवमंदिरम् ।

ઉદ્ધાસાવાહને ન સ્તઃ સ્થિરાયામુદ્ધવાર્ચને ॥ (શ્રીમદ્ ભાગવત)

તેમાં મનોમયી પ્રતિમા સિવાય બાકીની સાત પ્રકારની પ્રતિમાઓ ‘ચળ’ અને ‘અચળ’ આમબે પ્રકારની છે, જેમાં મારો નિવાસ છે. ‘પ્રતિષ્ઠા’ શબ્દનો અર્થ શ્રીમદ્ ભાગવત ઉપરની ભક્તરંજની ટીકામાં આ પ્રમાણે કર્યો છે કે, ‘પ્રકર્ષણ તિષ્ઠત્યસ્યાં ભગવાનિતિ પ્રતિષ્ઠા પ્રતિમા’ જેમાં ભગવાન વિશેષપણે રહે છે તે પ્રતિષ્ઠા-પ્રતિમા કહેવાય; અને જીવનમંદિરનો અર્થ પણ ‘જીવસ્ય ભગવતઃ મંદિરમ્’ જીવનું ભગવાનનું મંદિર એ પ્રમાણે કર્યો છે. તેમાં હે ઉદ્ધવ! અચળ પ્રતિમામાં સ્થિત મૂર્તિમાં નિત્ય આવાહન-વિસર્જન કરવાની જરૂર હોતી નથી.

ઋગ્વેદના સમયથી સનાતન ધર્મમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ‘વિષ્ણવે ચાર્ચતે’ (ઋગ્વેદ ૧/૧૫૫/૧)માં અર્ચાના ઉલ્લેખ છે. અર્ચા એટલે મૂર્તિ. સામવેદના ઉદ્ધમા બ્રાહ્મણમાં દેવમૂર્તિના ઉલ્લેખ સાથે નોંધવામાં આવ્યું છે કે ‘દેવાયતનાનિ કમ્યન્તે દૈવતપ્રતિમા હસન્તિ’ અર્થાત્ દેવતાઓના સ્થાન કંપે છે, દેવની પ્રતિમા હસે છે. અથર્વવેદમાં પ્રાર્થના કરતાં જણાવ્યું છે કે ‘एहि अश्मानमातिष्ठ अश्मा भवतु ते तनु ।’ (૨/૧૩/૪) ‘હે ભગવાન! આવો, આ પાષાણનિર્મિત પ્રતિમામાં નિવાસ કરો. આ પાષાણમયી પ્રતિમા આપનું શરીર બની જજો.’

મૂર્તિપૂજાની ઋષિઓ પાસેથી મળેલી અનુપમ ભેટ છે. એના મહત્ત્વને ન સમજનાર કેટલાક અનભિજ્ઞ લોકોએ પોતાની બાલિશતાથી આ સુગંધી પુષ્પને ચીમળાવી નાખ્યું છે. મૂર્તિને નહીં માનનારો મનુષ્ય

શ્રી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં

મૂર્તિ પ્રતિષ્ઠા અને પૂજનવિધિ

કેવળ પોતાના માનસશાસ્ત્રનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે.

માનવને ભગવાનની મનોહર મૂર્તિ નિહાળીને જીવનમાં ઉષ્મા અને આશ્વાસન પ્રાપ્ત થાય છે, થાકેલાની નવી ચેતના સાંપડે છે, નિરાશ થયેલા માનવના જીવનમાં નવી આશાઓનો સંચાર થાય છે, સાધકને માનસિક અવલંબન માટે આધાર મળે છે, કર્મયોગીનો જીવનપથ ઈશપ્રકાશથી પ્રકાશિત થઈ ઊઠે છે અને સિદ્ધોને એમાં જ પૂર્ણતાની અનુભૂતિનો પરિતોષ પ્રાપ્ત થાય છે.

સાધકને મૂર્તિના અવલંબન સિવાય બીજું કોઈ સારું માધ્યમ નથી. તેમજ મૂર્તિ જેવો બીજો કોઈ આનંદ નથી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અદ્વૈતવાદના હિમાલય જેવા ઉત્તુંગ શિખરને આંબનારા શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય પણ ભગવાનના સાકાર રૂપને નીરખવાની ઝંખના રાખે છે : ‘શરણ્યો લોકેષાં મમ ભવતુ કૃષ્ણોઽક્ષિવિષયઃ ।’ ભાગવતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને સમજાવવા માટે ઉદ્ભવને મોકલ્યા છે. ઉદ્ભવ ગોપીઓને સાકારિત કૃષ્ણને બદલે અણુએઅણુમાં અને ઘટઘટમાં વ્યાપેલા કૃષ્ણ-તત્ત્વની ઉપાસના કરવાનું સૂચવે છે. ગોપીઓ ઉદ્ભવનું આ જ્ઞાન સ્વીકારવા તૈયાર નથી. તેઓ ઉદ્ભવજીને કહે છે કે, ‘તારો આ વ્યાપક શ્રીકૃષ્ણ અમને શું કામનો ? અમને તો અમારી જોડે હસવાવાળો, રાસ રમવાવાળો, રીઝવવા અને રૂઠવાવાળો શ્રીકૃષ્ણ જોઈએ.’

ખરી રીતે જોતા મૂર્તિપૂજા એ બહુ ઉચ્ચ તત્ત્વ છે. ભાવપૂર્ણ અને તેજસ્વી જીવન જીવનારના હાથમાં મૂર્તિ આવે તો તે વિશ્વનો બાદશાહ બની જશે અને મહામદ ગિઝની જેવાના હાથમાં આવે તો તે મૂર્તિનું સોનું જોઈ ફટકો જ મારવાનો. એક જ મૂર્તિમાં છોકરાને રમકડું, કલાકારને શિલ્પ, ચિત્રકારને તેમાં પૂરેલા રંગો અને સોનીને અલંકાર દેખાશે. પરંતુ ભાવપૂર્ણ અંતઃકરણવાળા મનુષ્યના હાથમાં મૂર્તિ આવશે તો તેનું જીવન ઝળહળી ઊઠશે. જેમએક લાકડીથી નાનું બાળક ઘોડો ઘોડો રમે, તે જ લાકડી ગુંડો આવે તો રક્ષણ કરવા પણ કામ લાગે અને જો રક્ષણ કરતાં ન આવડે તો તે જ લાકડી ગુંડાને આપણી પર હુમલો કરવા ઉપયોગી બને.

કેટલાક લોકોનું કહેવું છે કે મૂર્તિનો આકાર તો કાલ્પનિક છે. મૂર્તિ એ કલ્પના હશે તો પણ તે પુનરુત્પાદક કલ્પના છે નહીં કે સર્જનાત્મક કલ્પના. ગત અનુભવનું સ્મરણ અને એ સ્મૃતિ મુજબ નવું ચિત્ર તૈયાર કરવું એનું જ નામ પુનરુત્પાદક કલ્પના. ઋષિને જે સાક્ષાત્કાર થયો હતો તેની તેને સ્મૃતિ થઈ અને તે સ્મરણ મુજબ શિલ્પકારે મૂર્તિ ઊભી કરી. આ જે ચિત્ર છે તેનું નામ કલ્પના. આવી રીતે કોઈ શાસ્ત્રીય દૃષ્ટિથી ‘કાલ્પનિક’ શબ્દ મૂર્તિ માટે વપરાતો હશે તો તે ખોટો નથી.

વળી, કેટલાક લોકો મૂર્તિપૂજા એ એક પગથિયું છે એમ કહીને નવું તૂટ ઊભું કરે છે. મૂર્તિ, જીવનવિકાસમાં આદિથી અંત સુધી આપણી જોડે રહે છે. માત્ર વીશ ફૂટ સુધી જ પ્રકાશ ફેંકનારી ટોચ આપણને વીશ માઈલ સુધી પણ લઈ જાય છે, કારણ કે આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ટોચનો પ્રકાશ પણ આપણી જોડે જ આગળ વધતો જાય છે. બરાબર તેવું જ મૂર્તિપૂજાનું પણ છે. જીવનવિકાસના માર્ગમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ મૂર્તિપૂજા આપણા માર્ગને નૂતન પ્રકાશ પ્રકાશિત કરતી જાય છે. વળી, મૂર્તિપૂજાને એક પગથિયું માનવું એ બારાક્ષરીને પગથિયું માનવા જેવું છે. જીવનની શરૂઆતમાં શીખેલી બારાક્ષરી જ માનવને મોટા મોટા પુસ્તકો વાંચવાની કે લખવાની યોગ્યતા પ્રદાન કરે છે. મોટા થયા પછી મને હવે બારાક્ષરીની જરૂર નથી એમ બોલવું એ જેટલી હાસ્યાસ્પદ વાત છે તેના કરતાં પણ વધારે હાસ્યાસ્પદ વાત થોડો વિકાસ થયા પછી મને હવે મૂર્તિની જરૂર નથી એમ કહેવું તે છે.

કોઈ કહે કે મૂર્તિ ભગવાનનું સ્વરૂપ હોય તો વિધર્મીઓએ મૂર્તિઓ તોડી ત્યારે ભગવાને કેમ કોઈ પણ પ્રતીકાર કર્યો નહિ ? તો તેનું સમાધાન શાસ્ત્રમાં છે કે ભગવાન જે જે અવતાર ધારણ કરે ત્યારે તે તે અવતારના જાતિગત પ્રકૃતિમય ભાવો જણાવે છે કે - જેમ મત્સ્યાવતાર થયો ત્યારે ભગવાનની માછલાં જેવી જ ક્રિયા હોય. તેને પાણી બહાર કાઢો તો તરફડીને મરી જાય. ભગવાન મનુષ્ય અવતાર ધરે ત્યારે મનુષ્યની જેમ જ હારવું, જીવતું, ડરવું, આનંદિત થવું વગેરે વગેરે ભાવો જણાવે. તેમ ભગવાન મૂર્તિસ્વરૂપે હોય ત્યારે આ અવતાર જડ પદાર્થમાં હોઈને જડ પદાર્થના ગુણધર્મો પ્રમાણે જ વર્તે. જેમજડ પદાર્થ ઉપર કોઈ તાડન કરે તો તે જડ પદાર્થ પ્રતીકાર ન કરે, તેમ અર્ચાવતાર ધારી ભગવાન વિધર્મીઓના જુલ્મો સહન કરી લે છે.

વિશ્વના બધા જ ધર્મોમાં એક યા બીજા રૂપમાં મૂર્તિપૂજાનો સ્વીકાર જાણે-અજાણે કરવામાં આવ્યો છે. બાહ્ય રીતે મૂર્તિપૂજાને અસ્વીકાર્ય ગણતા મુસ્લિમો કાબાના પથ્થરને પૂજ્ય માને છે ! ત્યાં જાત્રા કરવા ઉમંગભર જાય છે ! મૂર્તિપૂજામાં ન માનનારા યહૂદીઓ ઈઝરાયલમાં જેરુસલેમમાં ‘વેઈલીંગ વૉલ’ને પવિત્ર માની ત્યાં માથું ટેકવે છે. મૂર્તિપૂજામાં ન માનનારા ખ્રિસ્તીઓ કોસને માને છે. વેટીકન સિટીમાં સેન્ટ પીટર્સ બઝેલિકામાં મધર મેરીની ધાતુની મૂર્તિ છે. ખ્રિસ્તીઓએ એનાં ચરણસ્પર્શ કરીને એ મૂર્તિનાં ચરણ ઘસી નાંખ્યાં છે. એ ઘસાઈ ગયેલાં ચરણ સ્પષ્ટ જોઈ શકાય છે. શું આ મૂર્તિપૂજા નથી ? પોર્ટુગલમાં ફાતીમામાં એક ઓરડીમાં મેરીની મૂર્તિ છે. તેની આગળ મીણબત્તીઓ કરવાની માનતા(બાધા) રાખે





દર્મવંશી આચાર્યે ભગવાનનું જે
સ્વરૂપ પૂજા કરવા આપ્યું હોય અથવા
જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે જ
સ્વરૂપ સેવ્યા યોગ્ય છે. એ સિવાયના
બીજા સ્વરૂપ અર્થાત્ જે સ્વરૂપ
દર્મવંશી આચાર્યે સેવવા ન આપ્યું
હોય અથવા જે સ્વરૂપની પ્રતિષ્ઠા
દર્મવંશી આચાર્યે ન કરી હોય તે
સ્વરૂપ સેવવા યોગ્ય નથી પણ વંદના
કરવા યોગ્ય છે.

છે. મોટી સંખ્યામાં જાત્રાળુઓ આવે છે. કોઈ તો ઢસડાતાં ઢસડાતાં પણ
આવવાની ટેક રાખે છે. અરે, પોપ પણ ત્યાં દર્શને આવે છે. શીખોને પણ ગ્રંથ
સાહેબની આવશ્યકતા પડી છે. આ બધું બતાવે છે કે કોઈ ને કોઈ સ્વરૂપે
ભગવાનને અર્ચા સ્વરૂપે સ્વીકાર્યા વગર છૂટકો જ નથી.

મૂર્તિપૂજાની જરૂરિયાત ચિંત એકાગ્ર કરવા માટે છે એ વાત સ્પષ્ટ રીતે
સમજાય તો જ મૂર્તિપૂજાનું માનસશાસ્ત્રીય મહત્ત્વ ધ્યાનમાં આવે.
માનસશાસ્ત્રની નજરે જોતાં માણસનું મન કદી ખાલી રહેતું નથી. મન એકાગ્ર
થયા વગર તેનો વિકાસ થતો નથી કે શક્તિઓ ખીલતી નથી. તેથી મનને
એકાગ્ર કરવું જોઈએ. બીજી વાત મન આકાર વગર સ્થિર થતું નથી, તેને
અવલંબનની જરૂર છે. હવે જેનું અવલંબન આપણે તેનો આકાર મન ગ્રહણ
કરશે. તેના ગુણદોષોની અસર મન પર થશે. જડનું ચિંતન કરનાર જડ બને,
સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રી બને, તે જ રીતે ભગવત્સ્વરૂપમાં મન સ્થિર કરનાર
મનુષ્યનું મન ભગવત રૂપ બને છે. તેથી અન્ય કોઈનું ધ્યાન ન ધરતા
ભગવાનનું ધ્યાન ધરવું હિતાવહ છે. જેનું ધ્યાન ધરવાનું હોય તે સદાકાળને
માટે સર્વશ્રેષ્ઠ લાગવો જોઈએ. ભલા, ભગવાન સિવાય બીજું કોણ એવું હોય ?
વળી, મન બીજી કોઈ વાતમાં જાય તો ભગવાનની મૂર્તિ માનસપટ પરથી ખસી
જાય, કારણ કે મન એક સાથે બે ઠેકાણે રહેતું નથી. આ કારણે આપણને
આપણી ભૂલ ધ્યાનમાં આવે અને પુનઃ સાધનાની શરૂઆત કરી શકાય છે.

શ્રીજીમહારાજ પણ ગઢડા મધ્ય પ્રકરણના ચતુર્થ વચનામૃતમાં કહે છે કે જે
એમસમજતો હોય કે બીજા પાણામાં અને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે ? તેને
તો નાસ્તિક અને પાપિષ્ઠ જાણવો.

મંદિરોમાં મૂર્તિઓની ધોડશોપયારે પૂજા થાય છે. ભગવાન દિવ્યરૂપે બધી
પૂજા ગ્રહણ કરે જ છે. થાળ પણ દિવ્યરૂપે ગ્રહણ કરે જ છે. અર્ચાસ્વરૂપ
ભગવાન કોઈકવાર પોતાની સામર્થી બતાવવા ચમત્કારિક ઘટનાઓ પણ સર્જે
છે.

વનવિચરણ દરમિયાન મહાપ્રભુ શ્રી નીલકંઠવર્ણીના શાલિગ્રામએક વાર
જળ પી ગયા હતા. શામળાજીના ભગવાન ટોડલા ગામે ખુશાલ ભટ્ટ સાથે
રમવા પધારતા. ભક્તિરસમાં તરબોળ બની મીરાંબાઈ દ્વારિકાધીશની
મૂર્તિમાં સમાઈ ગયાં હતાં. જીવુબાની ભક્તિને વશ થઈ ઠાકોરજીની મૂર્તિએ
મૂર્તિમંત પ્રકટેલા ભગવાન કટોરો ભરી દૂધ પીતા હતાં. ગઢડામાં શ્રી
ગોપીનાથજી દેવની મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન શ્રીહરિએ બ્રહ્માનંદ
સ્વામીને હાર પહેરાવેલો. એટલે જ ભગવાન શ્રીહરિ ગઢડા પ્રથમ પ્રકરણના
૬૮મા વચનામૃતમાં કહે છે : “અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન અખંડ નિવાસ
કરીને રહે છે.”

મૂર્તિપૂજાનું આ મહત્ત્વ ધ્યાનમાં આવે તો ધૂપ, દીપ, પ્રાર્થના, સ્તુતિ, દર્શન
એ માત્ર ભગવાનની ખુશામત નથી પણ મનને સ્થિર કરવાની આપણી
તેયારીના એક ભાગ રૂપ પણ છે, એ સમજાય તો વારંવાર દર્શન કરવાથી
ભગવાનની મૂર્તિ માનસપટ પર સ્થિર થાય જેથી ધ્યાનમાં સુગમતા રહે.
પ્રાર્થના, સ્તુતિ કે ભજન પ્રભુનો મહિમા સમજાવી આપણું તેના માટેનું
આકર્ષણ વધારે છે. ગમતા માનવ પર મન જલદી કેન્દ્રિત થાય એ સ્વાભાવિક

વાત છે. વળી, ધૂપ, દીપ, અગરબત્તી, ફૂલ એ મનને પ્રસન્ન કરનારાં તત્ત્વો છે. પ્રફુલ્લિત મન જલદીથી પ્રભુચરણોમાં પ્રવેશ પામે એ નિશ્ચિત વાત છે.

અવ્યક્તની ઉપાસના અતિ કષ્ટદાયી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે :

‘ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ધિરવાપ્યતે ॥’

અર્થાત્ અવ્યક્તમાં ચિત્તની એકાગ્રતા કરવા ઈચ્છનારને અત્યંત કષ્ટ થાય છે, કારણ કે દેહેન્દ્રિય ધારણ કરનાર મનુષ્યને અવ્યક્તની ગતિ પ્રાપ્ત કરવી તે સ્વભાવથી જ અત્યંત કષ્ટદાયી છે.

મૂર્તિમાં લાંબા સમય સુધી મનને સ્થિર રાખવાની સાધના એ મનુષ્યનો પ્રયત્ન અને ત્યાર પછી એકાએક મૂર્તિમંત્રનું પ્રગટ દર્શન અને પૂર્ણતાની અનુભૂતિ થવી એ પરમાત્માની કૃપા. આ બંનેનું મિલન જ્યાં સધાય તે જ મનુષ્યજીવનની પરમોચ્ચ અવસ્થાનું દર્શન.

મૂર્તિપૂજામાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મનુષ્યને તારવાની શક્તિ અપ્રતિષ્ઠિત મૂર્તિમાં નથી પરંતુ પ્રતિષ્ઠિત મૂર્તિમાં છે. પરબ્રહ્મ પરમેશ્વર આ આકારમાં, આ મૂર્તિમાં છે એ ભાવનાની જ કિંમત છે. તેથી જ આપણે ત્યાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તે ક્ષણથી તે પ્રતિમા સામાન્ય મૂર્તિ મટીને પરમેશ્વર સ્વરૂપ બને છે.

સામાન્યપણે એવું કહેવાય છે કે -

‘અસ્માડપિ યાતિ દેવત્વં મહદ્ભિઃ સુપ્રતિષ્ઠિતઃ ।’ મહાપુરુષો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠિત થયેલી પથ્થર મૂર્તિ એક દેવ બની જાય છે. મૂર્તિમાં પ્રાણનું આવાહન એ મહત્ત્વનું અંગ છે. આ પ્રાણ-આવાહન કઈ વ્યક્તિ દ્વારા થાય છે તે પ્રમાણે મૂર્તિમાં દેવત્વ રહે છે આ પ્રમાણે લોકોક્તિ પણ છે.

પરંતુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરેક મહાપુરુષોને પ્રતિષ્ઠા કરવાનો હક્ક હોતો નથી. પ્રતિષ્ઠા બાબતમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે આજ્ઞા કરતા શિક્ષાપત્રીમાં કહ્યું છે :

‘આચાર્યૈર્ગૈવ દત્તં દત્તં વચ્ચક્ત્તેન પ્રતિષ્ઠિતમ્ ।

કૃષ્ણસ્વરૂપં તત્સેવ્યં વન્ધ્યમેવેતરત્તુ યત્ ॥’ (શિક્ષાપત્રી : શ્લોક - ૬૨)

ધર્મવંશી આચાર્ય ભગવાનનું જે સ્વરૂપ પૂજા કરવા આપ્યું હોય અથવા જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપ સેવ્યા યોગ્ય છે. એ સિવાયના બીજા સ્વરૂપ અર્થાત્ જે સ્વરૂપ ધર્મવંશી આચાર્ય સેવવા ન આપ્યું હોય અથવા જે સ્વરૂપની પ્રતિષ્ઠા ધર્મવંશી આચાર્ય ન કરી હોય તે સ્વરૂપ સેવવા યોગ્ય નથી પણ વંદના કરવા યોગ્ય છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનસમય

દરમિયાન અર્ચાસ્વરૂપોની પ્રતિષ્ઠા કરીને મંદિરોમાં પધરાવવા માટે અર્ચાસ્વરૂપો આપ્યા. પરંતુ શિક્ષાપત્રી લખ્યા પછી પોતાના સ્વરૂપો માટે એટલો વિવેક બતાવ્યો કે ભગવાન શ્રી સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ (અર્ચા) હોય પરંતુ તે જો ધર્મવંશી આચાર્ય પ્રતિષ્ઠા કરેલી ન હોય અથવા ધર્મવંશી આચાર્ય સેવવા માટે આપી ન હોય તો એ સેવ્ય સ્વરૂપ ન કહેવાય, કેવળ વંદના કરવા યોગ્ય (પ્રત્યક્ષના ઉપાસકને અન્ય અવતારોના સ્વરૂપોની માફક) કહેવાય.

આ ભગવાન શ્રી સ્વામિનારાયણનો હૃદયગત અભિપ્રાય તેમના વચન મુજબ જોતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય વ્યક્તિઓએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો આવિર્ભાવ થતો નથી. મૂર્તિ એ ભગવાનનું સ્વરૂપ છે એટલે તે મૂર્તિ વંદન કરવા યોગ્ય છે પરંતુ સેવા કરવા યોગ્ય તો કદાપિ ક્યારેય બની શકે જ નહિ. કારણ કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રીજમહારાજનો આ સર્વોપરી સિદ્ધાંત છે. હા, એ વાત ખરી. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત પરંપરાગત શુદ્ધ ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી દેશકાળ અનુસાર કોઈને પ્રતિષ્ઠા કરવાની આજ્ઞા કરે તો તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો આવિર્ભાવ થાય છે. કારણ કે તેમાં ધર્મવંશી આચાર્યશ્રીની આજ્ઞાથી એ પ્રતિષ્ઠા થતી હોવાથી તે પ્રતિષ્ઠા કરનાર આચાર્યશ્રીના પ્રતિનિધિસ્વરૂપ છે.

જે મૂર્તિની સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી હોય અથવા તેમના પદ ઉપર પરંપરાગત રીતે આરૂઢ થયેલા ધર્મવંશી આચાર્યશ્રીએ વેદોક્ત વિધિથી પ્રાણ-પ્રતિષ્ઠા કરાવવા પૂર્વક પધરાવી હોય તે મૂર્તિના દેવત્વમાં શું મણા હોય ? તેમાં પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંકલ્પથી પોતાનું પ્રગટપણું જે દ્વારા રાખેલું હોય તે મૂર્તિઓ માટે તો પૂછવું જ શું ? પરોક્ષમાં ભગવાત્ પ્રતિમાઓ, દેવ-દેવીઓની મૂર્તિઓ ઈત્યાદિ સ્થળે સ્થળે જોવામાં આવે છે, પણ તે માટે તો શ્રીમદ્ ભાગવત કહે છે : ‘તે ઉરુકાળે ફળે છે.’ પરંતુ તે ‘ઉરુકાળનો નિયમ’ આ પ્રગટ પ્રતિમાઓને લાગુ પાડી શકાય નહિ. આ પ્રતિમાઓ જે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પધરાવી છે અથવા એમની આજ્ઞા મુજબ ધર્મવંશી આચાર્યશ્રીઓએ પધરાવેલી છે તે દ્વારા તો એવું ને એવું જ પ્રગટપણું વર્તમાનકાળે પણ અનુભવવામાં આવે છે. આ દ્વારા અનંત જીવનાં પ્રકટ પ્રમાણ કલ્યાણ થયા છે, થાય છે ને થશે. એવો સંપ્રદાયના આશ્રિતોનો તેમજ અન્ય મુમુક્ષુઓનો પણ સ્વાનુભવ સર્વવિદિત-પ્રસિદ્ધ છે.

સ્વામી આનંદસ્વરૂપદાસજી
તથા
સાધુ અમૃતસ્વરૂપદાસ - સરધાર

જે ચાંદ્ર મહિનામાં સૂર્યનું સ્પષ્ટ ગતિ પ્રમાણેનું સંક્રમણ ન થાય, તે માસ અધિક માસ કહેવાય છે. સમગ્ર ભક્તિ સંપ્રદાયોમાં જે માસનો અત્યંત મહિમા છે અને જે માસમાં ભક્તિની મોસમપૂરજોશથી ખીલી ઊઠે છે, એ માસને ‘પુરુષોત્તમમાસ’ પણ કહેવાય છે. તેમજ ‘મળમાસ’ પણ કહે છે.



અધિક માસ મળમાસ શા માટે ?

અધિક માસને ‘મળમાસ’ કહે છે. તે માટે જ્યોતિષના ગ્રંથોમાં કહ્યું છે :

‘શકુન્યાદિચતુષ્કં તુ રવેર્મલમુદાહતમ્ ।
તદ્ધર્વ્યં ક્રમતે ભાનોર્માસઃ સ્યાતુ મલિમ્લુચઃ ॥’

(પુરુષોત્તમ માસ માહાત્મ્ય : પેજ. ૧૧.)

અર્થાત્ ‘શકુનિ, ચતુષ્પદ, નાગ, અને કિંસ્તુઘ્ન એ ચાર કરણો રવિનો મળ ગણાય છે, અને તે કરણોમાં જે સંક્રાંતિ શરૂ થાય છે તે સંક્રાંતિનો સમય ‘મળમાસ’ કહેવાય છે.’

જ્યોતિષની ફલસંહિતાઓમાં રવિસંક્રમણ વખતના કરણનું ઘણું ફળ કહેવામાં આવ્યું છે, એટલે બવાદિ સાત કરણો જે ચાર કરણોમાં છે તે અને શકુનિ આદિ ચાર સ્થિર કરણોના ફળનો મોટો તફાવત હોઈ શકુનિ આદિ ચાર કરણને સૂર્યનો મળ કહ્યો છે, અને તેથી તે કરણોમાં શરૂ થતી સંક્રાંતિનો સમય ‘મળમાસ’ કહેવાય છે.



મળમાસમાં શુભ કર્મ શાથી ન થાય ?

આ મળમાસમાં શુભ કર્મો કરવાનો નિષેધ છે, તેનું કારણ બતાવતાં પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જ્યારે ચંદ્ર સૂર્યના મંડળમાં હોય ત્યારે જો સૂર્ય રાશિસંક્રમણ કરે, ત્યારે તે યજ્ઞના ઉત્સવ વગેરેનો નાશ કરે છે, માટે તેમાં શુભ કર્મો ન કરવાં, અને તેમાં ઈશ્વર-આરાધના માટે સ્નાન-દાનાદિ ક્રિયાઓ કરવી. શાસ્ત્રનું શ્રવણ કરવું; દીપ-દાન કરવું તથા વ્રત નિયમો પાળવા વગેરે કરવું પરંતુ નકામો સમય જવા દેવો નહિ.



અધિક માસ-પુરુષોત્તમમાસ અને તેનો એટલો બધો મહિમા શાથી ?

આ માસના માહાત્મ્યની કથાનો વિસ્તાર નારદીય પુરાણમાં ૩૧

પુરુષોત્તમ માસ -

અધિક માસ માહાત્મ્ય

અધ્યાયોમાં વર્ણવાયો છે. તેની કથા આ પ્રમાણે છે :

પૂર્વકાળમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, અંગિરા, વામદેવ વગેરે ઋષિવર્યોનું મહાન સંમેલન યોજાયું. એ સમયે સૂતપુરાણી તીર્થયાત્રા કરતાં અહીં આવી ચડ્યા. ઋષિઓએ તેમને આસન આપી પ્રેમથી પધરાવ્યા. અને મોક્ષ આપનાર કથાનું વર્ણન કરવા વિનંતી કરી.

સૂતજીએ કહ્યું : “એક વાર નારદજી નરનારાયણ ઋષિના આશ્રમે પધાર્યા હતા. એમણે સ્તુતિ કરીને કહ્યું : હે પ્રભુ ! કળિયુગમાં વધતા જતા વિષય વિલાસના વાતાવરણમાં નિર્ભયપણે મોક્ષપ્રાપ્તિ કરવાનો શો ઉપાય છે ?”

નારાયણ ઋષિએ કહ્યું : “હે મુનિવર્ય ! જો માનવ પુરુષોત્તમભગવાનના સારરૂપ લીલાચરિત્રોનું શ્રવણ કરે, તો કળિયુગમાં પણ ભગવાન મોક્ષ આપે છે !

જ્યારે આ માસની ઉત્પત્તિ થઈ ત્યારે આ માસને ધણી વિનાનો જાણી ધણીવાળા ચૈત્ર વગેરે માસો, લવ-પખવાડીયા-ઘડીઓ-પ્રહરો-રાત્રિઓ-ઋતુઓ-નદીઓ-સમુદ્રો-વૃક્ષો-વેલીઓ-પર્વતો વગેરે બધા જ ધણીવાળાએ આનું અપમાન કરવા માંડ્યું. જ્યારે જ્યારે ત્યાં એનું અનાદર અને અપમાન થવા માંડ્યું ત્યારે તે નિસ્તેજ બની ગયો. જ્યારે સર્વ પ્રકારે બહિષ્કૃત કરેલા આ માસે જાણ્યું કે હવે ભગવાન સિવાય મારો કોઈ ધણી નથી એમજાણી અશરણ-શરણ, પતિતપાવન, અધમોદ્ધારક ભગવાન શ્રી વિષ્ણુને શરણે ગયો. વિષ્ણુને સમગ્ર પોતાનું દુઃખ નિવેદન કર્યું. ભગવાન શ્રી વિષ્ણુ તેનું અસહ્ય દુઃખ સાંભળી પોતાને તેના ઉપર અત્યંત દયા આવી, પોતાથી તેનું દુઃખ ટાળી શકાય તેમનહિ હોવાથી વિષ્ણુ ભગવાન તેને ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રની પાસે લઈ ગયા અને તેનું જે દુઃખ હતું તે શ્રીકૃષ્ણને કહ્યું.

ત્યારે શ્રીકૃષ્ણએ વિષ્ણુને કહ્યું : “હે વિષ્ણો ! આ મળમાસનો હાથ પકડીને તમે તેને અહીં લાવ્યા તે ઠીક કર્યું. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે એમજાણો. તેથી આ મળમાસને હું મારા જેવો જ સર્વોત્તમ બનાવીશ.”

एतन्मासाधिपश्चाहं मयैवायं प्रतिष्ठितः ।

पुरुषोत्तमेति मन्त्राम, तदप्यस्मै समर्पितम् ॥

(પુ. મા. : ૧. બૃ. ના. પુરાણ : ૭-૨૫.)

“હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, છ ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે જે ગુણોથી આ લોકમાં પુરુષોત્તમતરીકે પ્રખ્યાત છું તે સર્વ ગુણો આજથી મેં આ માસને અર્પણ કર્યા છે. મારામાં જે જે ગુણ રહ્યા છે તે તે બધા આ માસને પ્રાપ્ત થાઓ. તેમજ લોકમાં અને વેદમાં મારું

‘પુરુષોત્તમ’ એવું નામપ્રસિદ્ધ છે તે પણ હે વિષ્ણો ! હું આ માસને આપું છું, આ માસનો સ્વામી પણ આજથી હું જ થયો છું. આના નામથી જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી, આ જગતમાં પૂજ્ય તથા વંદનીય થશે. આ માસની પૂજા કરનારના સર્વ દારિદ્ર્યનો આ નાશ કરનારો થશે. આ માસમાં તપ કરશે, તેની ઈન્દ્રિયો જિતાશે. બધા મહિનાઓ તો કામનાવાળા છે પણ આ માસને હું નિષ્કામકરું છું. સર્વ લોકોને આ મોક્ષદાતા થશે, હું આ માસને મારા જેવો જ કરું છું, જે મનુષ્યો સકામકે નિષ્કામભાવે આ અધિક માસનું પૂજન કરશે તે પોતાનાં સર્વ કર્મોને બાળી ભસ્મકરીને અવશ્ય મને પામશે.”



અધિક માસનું વિશેષ ફળ

પ્રાચીનાચાર્યોએ પોતાના અનુભવથી લખ્યું છે કે, જો ચૈત્ર અધિક માસ હોય તો જગત ઉપર વસ્તુઓની સુલભતા, પ્રજાનું આરોગ્ય અને માફકસરની વૃષ્ટિ થાય છે. વૈશાખ અધિક માસ હોય તો પ્રજા સુખી રહે છે, વરસાદ સારો થઈ ધાન્ય સારાં પાકે છે. જેઠ અધિક માસ હોય તો તાવ, અતિસાર (કોલેરા) વગેરે રોગોથી પીડા થાય છે. અષાઢ અધિક માસ હોય તો યજ્ઞાદિ કાર્યો ખૂબ થાય છે. પ્રજા ખૂબ પુણ્યકાર્યો કરે છે અને જગત ઉપર સુખ રહે છે. શ્રાવણ અધિક હોય તો બધું જ વાસ્તવિક રહે છે; અર્થાત્ પ્રજા સુખી રહે છે, વૃષ્ટિ માફકસરની થાય છે. ભાદરવો અધિક હોય તો નિમ્ન વર્ણવાળાની વૃદ્ધિ થાય છે, સત્તાવાળાઓ અંદરોઅંદર લડે છે. આસો અધિક હોય તો પ્રજા દુશ્મનોના સૈન્યથી તેમજ ચોર લોકોથી પીડા પામે છે. દક્ષિણના પ્રદેશોમાં દુકાળ પડે છે, જ્યારે બીજે વૃષ્ટિ સારી થઈ બધાં જ ધાન્ય પાકે છે. જો કાર્તિક અધિક હોય તો ધાન્ય સારાં પાકે છે, પ્રજા સંતુષ્ટ રહે છે, ખૂબ યજ્ઞો થાય છે. માગશર અધિક હોય તો પ્રજા નીરોગી રહે છે; તેમજ સુકાળ રહે છે, કોઈ દુઃખી થતું નથી. ફાગણ અધિક હોય તો રાજસત્તા બદલાય છે, સુભિક્ષ (સુકાળ) રહે છે અને પ્રજાને સુખ રહે છે. (આગામી વિ.સં. ૨૦૬૬ની સાલમાં વૈશાખ માસ અધિક છે અને ૨૦૬૮ની સાલમાં ભાદરવો માસ અધિક છે એવી હકીકતની એકત્ર નોંધ કરવામાં આવેલી છે.)



અધિક માસની માહાત્મ્ય કથાઓ

દ્રોપદીના પૂર્વજન્મની એક કથા પણ આ

શ્રી સ્વામિનારાયણ ચિંતન ✽ મે - ૨૦૦૭



સંદર્ભમાં જણાવવામાં આવી છે :

દ્રોપદી પૂર્વજન્મમાં મેધાવી મુનિની મેધાવતી નામે મહાપંડિતા પુત્રી હતી. તેને યોગ્ય કોઈ વર ન મળ્યો, તેની ચિંતામાં ને ચિંતામાં મુનિનું અવસાન થઈ ગયું. અન્ય મુનિઓ સહિત મેધાવતી ખૂબ રડી. પણ પછી ધીરજ રાખી પ્રભુ-ભજન કરવા લાગી. એક વાર એ આંસુ સારતી બેઠી હતી, ત્યાં કોધમૂર્તિ દુર્વાસા આવી પહોંચ્યા. મેધાવતીએ તેમનું આદર થકી સ્વાગત કર્યું. પોતાની દુઃખદ કહાની તેણે દુર્વાસા ઋષિ પાસે નિવેદિત કરી. ઋષિવર્યે તેને ‘પુરુષોત્તમમાસ’નું વ્રત-તપ કરવા આજ્ઞા કરી અને કહ્યું : “હે બાળા ! એક વાર અંબરીષની રક્ષા કરવા અને મને બાળી નાખવા ભગવાને સુદર્શન મોકલ્યું હતું, તેનાથી રક્ષા પામવા મેં પુરુષોત્તમમાસનું જ વ્રત કર્યું હતું.

‘મામેવ ભસ્મસાત્કર્તું તદાન્તં પ્રેરિતં મયિ ।

પુરુષોત્તમવ્રતાદેવ તત્ત્વક્રં સંન્યવર્તત ॥’

(પુ. મા. : બૃ.ના. પુરાણ : ૧૦-૧૪.)

પરંતુ દુઃખથી ત્રાસેલી મેધાવતીએ કોઈ પણ માસનું વ્રત કરવાનો કોધપૂર્વક ઈન્કાર કરી દીધો. દુર્વાસાએ તેને શાપ આપતાં કહ્યું : “હે બાળા ! તેં પુરુષોત્તમમાસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને અવશ્યપણે આ જન્મે કે આવતાં જન્મમાં મળશે જ !” આ શાપથી ગભરાઈને તેણે ભગવાન શંકરની આરાધના કરવાનું શરૂ કરી દીધું.

એ માત્ર માનસિક આરાધના જ નહોતી ! પરંતુ તીવ્ર તપ હતું. અનાહાર રહેવું, દર્ભાસન રાખવું, પાણીમાં હોઈ સુધી ઊભા રહી પ્રભુ-સ્મરણ કરવું વગેરે તપશ્ચર્યાથી શિવજી પ્રસન્ન થઈ ગયા. દર્શન દઈ તેને વરદાન માગવા કહ્યું. ઉતાવળ અને અત્યંત આનંદને કારણે તે બોલી ઊઠી :

‘પતિં દેહિ પતિં મહ્યં પતિં પતિમહં વૃણે ।

પતિં દેહિ મહાદેવ ! નાન્યમે ચિન્તિતં હૃદિ ॥’

(પુ. મા. : બૃ.ના. પુરાણ : ૧૧-૨૫.)

‘હે મહાદેવ ! મને પતિ આપો ! પતિ આપો ! પતિ આપો !’ - આમપાંચ વાર તેણે માત્ર પતિનું વરદાન માગ્યું. ભગવાન શંકરે તેને એક સાથે પાંચ સમર્થ પતિ મળવાનું વરદાન આપી દીધું !

મેધાવતીને આ વિચિત્ર વરદાનથી આઘાત લાગ્યો. ત્યારે મહાદેવે કહ્યું : “તેં પુરુષોત્તમમાસનો અનાદર કર્યો હતો, તેનું જ આ પરિણામ છે !”

આખરે તેને બીજા જન્મમાં યજ્ઞકુંડમાંથી અવતાર મળ્યો, પાંચ પાંડવો તેના પતિ થયા. એટલું જ નહીં, પુરુષોત્તમમાસના અપમાન બદલ, ભરી સભામાં તેની લાજ લૂંટાય તેવી વેળા આવી

પહોંચી ! દુઃશાસન, દુર્યોધનનાં વજ્ર જેવાં કઠોર વચનો સાંભળવાં પડ્યાં.

ભગવાન શ્રીકૃષ્ણ પાસે આ આખ્યાન સાંભળ્યા પછી પાંચે પાંડવોએ દ્રોપદી સહિત પુરુષોત્તમમાસનું વ્રત કર્યું હતું અને તેનાથી જ તેઓ સર્વ રીતે સુખને પામ્યા હતાં.



આ ઉપરાંત બીજી એક કથા રાજા દંડધન્વાની છે :

એ રાજાને ચાર પુત્રો હતા. સંપત્તિ હતી, ગુણવંતી નારી હતી. પણ તેને એક રાત્રે વિચાર આવ્યો : “મેં તપ, દાન, વ્રત, હોમ-હવન કાંઈ કરતાં કાંઈ કર્યું નથી, છતાં મને આવું સુખ શાથી પ્રાપ્ત થયું હશે ?...”

વિચારમાં ને વિચારમાં બીજા દિવસે તે શિકાર કરવા ગયો. અનેક પશુઓને માર્યા, પણ એક મુગ બાણથી લોહી ઝરતા શરીરે ભાગી નીકળ્યો. તેની શોધમાં ફરતો રાજા થાકીને એક વડ નીચે બેસી ગયો.

એવામાં એક માનવભાષી પોપટ આવીને બોલવા લાગ્યો :

‘વિદ્યમાનાતુલં સુખમાલોક્યાતીવ ભૂતલે ।

ન ચિન્તસિ તત્ત્વં ત્વં તત્ત્વં કથં પારમેષ્વસિ ॥’


(પુ. મા. : બૃ.ના. પુરાણ : ૧૩-૪૩.)

‘તું અપાર સુખી છે, પણ તત્ત્વનો વિચાર નથી કરતો, તો (ભવસાગર) પાર કેમ પામીશ ?’

રાજા આ સાંભળી વિચારમાં પડી ગયો. ત્યાં તેની સેના આવી પહોંચી અને પોપટ પણ અદૃશ્ય થઈ ગયો. રાજાએ પોપટના પ્રશ્નના વિચારમાં ને વિચારમાં ઊંઘ ને આહાર છોડી દીધાં. ઘણા દિવસો બાદ મહર્ષિ વાલ્મીકિ તેમના મહેલમાં પધાર્યા. રાજાએ પોપટના પ્રશ્નની વાત કરી ત્યારે વાલ્મીકિએ તેને તેના પૂર્વજન્મની કહાની સંભળાવતાં કહ્યું : “રાજન્ ! પૂર્વ જન્મે તું દ્રવિડી બ્રાહ્મણ સુદેવ હતો. તને કોઈ સંતાન નહોતું ત્યારે તારી પત્ની ગૌતમી સામે તું ઘણી વાર નિરાશ ઉદ્ગારો વ્યક્ત કરતો. છેવટે ઉગ્ર તપ કરીને તેં અને તારી પત્નીએ ભગવાન શ્રીકૃષ્ણને રીઝવ્યા. પ્રભુએ તને પુત્રપ્રાપ્તિના આશિષ આપ્યા.”

‘પુત્ર તો જન્મ્યો, પણ તેનું માત્ર બાર વર્ષની ઉંમરે વાવમાં ડૂબી જવાથી મૃત્યું થયું. આઘાત અને શોકથી એ બ્રાહ્મણ દંપતી આહાર-નિદ્રા ભૂલી ગયાં. એ સમય અધિક માસ હતો. સુદેવ અને ગૌતમીએ અજાણતાં જ બાળકના શબ પાસે આખો માસ નિરાહાર ગાળી દીધો. પ્રભુએ તેને પુરુષોત્તમમાસનું વ્રત સમજી લીધું અને પુત્રના શબમાં એમણે ચૈતન્યનો સંચાર કરી તેને સજીવન કરી દીધો ! એ પછી એ વ્રતના પ્રતાપે તું આ જન્મે રાજા થયો, પણ હવે વિલાસમાં પડીને જીવન વ્યર્થ ગુમાવવા





કરતાં પ્રભુ-ભજન કરી ભવસાગર પાર ઊતરી જજે !

રાજાએ ઋષિની વાણી શિર પર યડાવી.

આવી અન્ય કથાઓ દ્વારા પદ્મ પુરાણમાં પણ પુરુષોત્તમમાસ - માહાત્મ્યને દેઢ કરાવવામાં આવ્યું છે.



વિશેષમાં આ પુરુષોત્તમમાસમાં યથાશક્તિ વ્રત-દાન-તપ પરાયણ રહીને ભગવાનની ભક્તિનું બળ સવિશેષ વધારવાનું હોય છે, તેને અનુલક્ષીને.....નિષ્કામ-ભાવથી પ્રભુ પ્રસન્નતાર્થે કરેલા પૂજા-યજ્ઞાદિથી પણ ભગવાન શ્રીહરિના પ્રીતિપાત્ર થવાય તો તેવા ભગવદ્ આરાધનામય યજ્ઞાદિ પણ એહિક-પારલૌકિક શ્રેયસ્કારી જરૂર બની જાય છે. તે માટે કોઈ પણ વ્રત-દાન-યજ્ઞાદિથી ભગવત્પરાયણ થવું એ જ આ પુરુષોત્તમમાસનો અધિક લાભ માનેલો છે.

ઉપરોક્ત હેતુ અનુસાર તેમજ અહિંસામય યજ્ઞ તથા વિપ્ર પ્રિય ભગવાન શ્રી સ્વામિનારાયણની ડભાણ, જેતલપુર વગેરેમાં પ્રવર્તાવેલી સર્વહિતાવહ પરંપરાને જીવંત રાખવા માટે વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની કુળપરંપરા મુજબ દર અધિક માસમાં સમસ્ત સત્સંગ સમાજના હિતને માટે સંપૂર્ણ એક મહિના સુધી યજ્ઞાનુષ્ઠાન કરવામાં આવે છે.

જેમાં દક્ષિણ વિભાગસ્થ તમામ નાના-મોટા હરિમંદિરોના દેવોના નામથી પ.પૂ. મહારાજશ્રી દ્વારા યજ્ઞદ્રવ્ય-બીરંજ આદિની આહુતિઓ અર્પવામાં આવે છે અને તેનાથી સંતુષ્ટ થયેલા દેવો દ્વારા સમગ્ર સત્સંગના શ્રેયસની શુભકામના સાકારિત કરવામાં આવે છે. તો આ ચાલુ વર્ષે પણ અધિક જેઠ માસ આવી રહ્યો છે તો તેમાં પણ આવા અલૌકિક યજ્ઞના દર્શનાદિ કરીને અલભ્ય લાભ લેવા યોગ્ય છે. આ યજ્ઞમાં પચાસથી સો જેટલા વિપ્રો પ.પૂ. ધ.ધુ. મહારાજશ્રીના નિવાસસ્થાને શ્રી રઘુવીરવાડીમાં એક મહિના સુધી અખંડ નિવાસ કરીને સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણનું આરાધનામય યજ્ઞથી પૂજન કરાવે છે. પ.પૂ. ધર્મકુળ દ્વારા આ વિપ્રોને ભોજન-દક્ષિણાદિથી ખૂબજ સંતુષ્ટ કરવામાં આવે છે. અને આ રીતે ‘યજ્ઞો વૈ વિષ્ણુઃ’ એમાં કહ્યા મુજબ તે પુરુષોત્તમમાસના યજ્ઞ-અનુષ્ઠાનનાં દર્શનનો લાભ પણ અચૂક લેવા જેવો બની રહે છે !!!

અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.

(કમશઃ)

અનુસંધાન પાન નં. ૧૯ પરબું

શ્લોક આવડતો હશે તે મોટેથી બોલી ગયા. અને પેલી બહેનને હાથ જોડી વળી ઓરડીમાં જવા વિનંતી કરી. એનાં ગયા પછી મૂળજી સવાર થતાં સુધી પથારીમાં બેસી રહ્યા. ત્રીજું જોખમ આવે ત્યારે વધારે ખતરનાક નીવડે છે. સવાર થયું. બાઈનાં મોંઢા ઉપર ભોંઠપ લીપાઈ ગયેલી. ને મૂળજીનાં મનમાં મંથન. “કેવો છે આ સંસાર ! અહીં રહેવામાં સાર નથી.” આખે રસ્તે એમને આજ પૂન ચાલું રહી.

ઘેર ગયા ત્યાં વળી બીજો ધક્કો લાગ્યો. પિતા કહે, ‘મૂળજી, માગું આવ્યું છે, જે બાઈને પિયર પહોંચાડી તેની નાની બેન -’

‘ના, બાપલિયા ના,’ મૂળજી વલોવી નાંખે એવી વાણીથી બોલી ઉઠ્યા. “મારે ગૃહસ્થાશ્રમ માંડવો નથી.” પિતા આ સંસારની એક પરંપરા સાચવવા મથ્યા અને પુત્ર બીજી પરંપરાને વળગી રહ્યા. “કુળમાં કોઈતો સન્યાસ લે કે નહિ, બાપુ ? આખું કુળ તરી જાય એવું હું કરીશ. મને રજા આપો.”

બાપાએ ખૂબ સમજાવ્યા છતાં પુત્રનો દેઢ નિશ્ચય જોઈને એમણે નમતું મૂક્યું. એમણે મન મનાવી લીધું. ‘મૂળજી ક્યાં કંઈ ખોટું કામ કરવા નીકળ્યો છે ? એની ઈચ્છા જ ન હોય પછી સંસારનું બંધન કેટલું ટકશે ? ભલે, એને ફાવે તેમ કરે.’

મૂળજી ઘેરથી હળવા હેયે નીકળી પડ્યો. વિચાર કર્યો કે દ્વારકા જાઉં. પછી જાણ્યું કે રામાનંદ સ્વામી બહુ સમર્થ છે. લોજ આવ્યા, સદ્ગુરુએ એમનો વેરાગ્ય પારખી લીધો. ને વૈષ્ણવી દીક્ષા આપી નામપાડ્યું મુકુંદાનંદ.

મુક્તિ દદાતીતિ મુકુન્દઃ મુક્તિ આપે તે મુકુંદ. મુકુન્દને આનન્દો યસ્ય સઃ મુકુન્દાનન્દ : મુકુંદ દ્વારા જ જે આનંદ પામે છે તે મુકુંદાનંદ એવું અન્વર્થવાળું નામ પાડ્યું.

ઈચ્છા કરતાં ઘણું મળ્યું એટલે એમનો આનંદ સમાતો નહોતો. એવામાં ગુરુ સ્વધામ ગયા અને તેમને સ્થાને ઉત્તરાધિકારી ગુરુએ પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું. સ્વામિનારાયણનો મંત્ર પ્રચલિત કર્યો સમાધિ પ્રકરણ ચાલું કર્યું અને ચારે તરફ એની ધૂમમચી ગઈ. મુકુંદાનંદને થયું કે ભાગ્ય ઉઘડી ગયાં. અક્ષરધામમાંથી બાંધેલી જોડ મળી.



સાધુ યોગેશ્વરદાસ

ગુરુ : પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

(અત્રે પ્રસ્તુત છે - ભારતીય સંસ્કૃતિના ગૌરવને જાણવા અને જીવંત રાખવા માટે એક સમીક્ષાત્મક દૃષ્ટિથી અધ્યયન કરવા યોગ્ય પાશ્ચાત્ય વિકૃતિની વિપરીત અસરનું વર્ણન કરતો સજ્જનોના અનુભવોનો અહેવાલ...)

આજે કોઈક યુવા કોલેજિયનોને પૂછો કે તમારી દૃષ્ટિએ સૌથી આગળ પડતા દેશો કયાં? ત્યારે તેઓ આંખમીંચીને લંડન, અમેરિકા, યુરોપ વગેરે પશ્ચિમ દેશોના નામ બોલવા માંડશે.

પહેલી કહેવત છે ને, ડુંગર દૂરથી રળિયામણાં...!

આજની સ્કુલ અને કોલેજોની અંદર રીસેસમાં છોકરાઓના ટોળેટોળામાં ૭૦% જેટલી વાતોમાં પશ્ચિમના દેશોની પ્રશંસા જ સાંભળવા મળશે. જે દેશોમાં દારૂ ઢીંચીને બગીચા વગેરેમાં પડી રહેલા યુવાનોનું દર્શન તદ્દન સ્વભાવિક હોય, એવા પશ્ચિમી દેશોના માત્ર બાહ્ય ઝાક-ઝમાળ જોઈને ગાણા ગાતા રહેવા તથા તેની જીવન પદ્ધતિના વકીલ બનવું, તે કોઈપણ ભારતીય સંસ્કૃતિ પ્રેમી સજ્જનને શોભે તેમ નથી.

એક વાત હૃદયમાં જડબેસલાક બેસાડી દેજો કે આપણા સંતોએ દીધેલી સંસ્કૃતિ દુનિયાના કોઈપણ દેશમાં નથી. ત્યાં અર્થકામની ઉત્તેજનાઓના નકરા વાનરવેડા છે. તે લોકો નિર્દોષ પશુઓનું માંસ ખાય છે. શુદ્ધ અને સાત્ત્વિક દૂધ પીવા માટે તે પ્રજા લાખો ગાયોને ઉછેરે છે, પણ તે ગાય જેવી વસુકે છે કે તરત તેને કાપી નાખીને બધું માંસ ખાઈ જાય છે. ન જીવદયા, ન કૃતજ્ઞતા, ન પરાર્થ... એકલી કૂરતા!

આતો કેવી જંગલીયત કહેવાય?

વિદેશોમાં ઘર છે કુટુંબ નથી, ત્યાં તો હવે ઘર પણ તૂટવા લાગ્યું છે. લોકો હોટલો કે મોટેલોમાં રહેવા લાગ્યા છે. ઘણાખરાને લગ્ન જીવનનું બંધન પસંદ નથી. ઘણીબધી છોકરીઓ કુંવારી રહે છે. કુંવારી રહીને લગ્ન જીવનનો અનુભવ કરે છે. બનતા સુધી તે મા બનતી નથી પરંતુ જો ગર્ભ રહી જાય તો નિષ્કુર પણે ગર્ભપાત કરાવી નાખે છે.

આ લોકો એટલા બધા સ્વાર્થી હોય છે કે તેમને પોતાના ભૌતિક વિકાસ સિવાય કશામાં રસ હોતો નથી. તેઓ સંતાનોને જન્મઆપીને પહેલા દિવસથી જ જુદા મુકી દે છે. રડે તો ભલે આખી રાત રડે, એ તો કાયમના છૂટા પડવા માટેની તાલીમનો પ્રથમ હિસ્સો છે. નોકરીના જીવનમાં 'સંતાનો' કાંટારૂપ લાગે એટલે એમને બેબી સીટીંગમા મૂકી

એક આર્ય-અનાર્ય સંસ્કૃતિનું

સમીક્ષાત્મક અધ્યયન, અનુભવીની દૃષ્ટિએ

પશ્ચિમ પરસ્ત

ભારતીયજનો !

દેવાય, પછી કે.જી.માં દાખલ કરાય. ધવડાવવામાં તો સૌન્દર્યનો નાશ થાય (!!!) એટલે બેબીકુડથી જ એ આફત ટાળી દેવાય. આ સંતાનો મોટા થઈને તેના મા-બાપને ઘરડાઘરમાં નાંખી દે છે. જ્યાં રિબાઈને મરવાના દા'ડા આવે છે.

શું થાય? સાઈકલ જ પૂરી થઈને? ઘોડીયાઘરથી ઘરડાઘર સુધીની? એવું જ ગર્ભપાતથી મર્સીકુલ-ડેથ સુધી બને છે.

ત્યાં તો ફિઝમાં મુકી રાખેલા શાક અને બ્રેડ ખાઈ લેવાના હોય અહીંની જેમ માતાના હેતથી બનાવેલી રસોઈ જમવાની તો વાત જ ક્યાંથી હોય?

ઢગલા બંધ નબાપા-નમાતા સંતાનો!

નકરો સ્વાર્થ! નકરી ધનલાલસા! સર્વત્ર ધનનો મહિમા!

ના... ધન કરતા જે ચડિયાતી વસ્તુ છે તે પ્રેમહૂંફ વાત્સલ્ય, સ્નેહનું ક્યાંય નામનહિ, ડીક્ષનેરીમાં જ શોભતા એ શબ્દો!

અર્થ ગુમાવી બેઠેલા એ શબ્દો! મડદાઓ! કોઈ કોઈને ન ચાહે, સહુ ધનને ચાહે, કોઈને કોઈ નિયંત્રણ નહિ! સર્વત્ર બેફામ ભોગરસ સગા ભાઈ-બહેન વચ્ચે પણ મર્યાદા નહિ, દર અઢાર બાળકે સત્તર બાળકો ગેરકાયદેસર!

દશ દશ માતાઓમાં સાત કુંવારી માતાઓ!

આઠ ટકા યુવાનો અર્ધ પાગલની દશામાં!

સર્વત્ર ડ્રગ્સ, ડ્રિન્ક્સ, ડાન્સ, ડિસ્કોની બોલબાલા!

સો સો ફૂટે બાર પબ! મટનની હોટલો! હાય! અધર્મતા!

આ છે પશ્ચિમનું ચલચિત્ર અને સંસ્કૃતિ.

ગોરાઓની પાસે કોઈ સંસ્કૃતિ નથી આ દેશની પ્રજા જેવું કોઈ માળખું નથી. એમની પાસે આદર્શ નથી. જવલંત ઈતિહાસ નથી. બલિદાનોની શૌર્યવંતી ગાથાઓ નથી. સતીઓના જૈહરની ઝિંદાદિલી ભરી કથાઓ નથી. હા...છે? ભોગના નકરા વાનરવેડા...

પશ્ચિમની સંસ્કૃતિને વરેલા મુંબઈની સન એન્ડ સેન્ડ હોટેલમાં ગયેલા પતિ-પત્નિએ આઠ વર્ષના બાબાને બહાર બેસાડીને એક રૂમમાં જઈને પુષ્કળ દારૂ ઢીંચ્યો. બે કલાકે બહાર આવ્યા બાદ સોફાસેટ ઉપર ઉંચી ગયેલા બાળકને ઉઠાડીને ઈમ્પોર્ટેડ દારૂના એક પેગની પ્યાલી પીવા માટે આપી. તે ચાખતાની સાથે બાબાએ કહ્યું : “મમ્મી! મને આ વસ્તુ ભાવતી નથી, હું નહિ પીઉં.” મમ્મીએ વહાલ કરતા કહ્યું : “બેટા! આ દારૂ છે, તું પીતાં નહિ શીખે તો મોડર્ન સમાજ સાથે તું શી રીતે હળીમળીને એકરસ બની શકીશ?”

હાય! મોડર્ન સમાજમાં એકરસ થવાની લાલસા! નવી પેઢીના પશ્ચિમની સંસ્કૃતિને વરેલા મા-બાપો દ્વારા જ નીકળતો

સત્યાનાશ! ક્યાં ઓલી ગંગા, મદાલસા, અનસૂયા! ક્યાં આ સંતાનોને મોડર્ન બનાવતી પશ્ચિમની સંસ્કૃતિની મમ્મીઓ!

અમેરિકાથી આવેલા એક માતા એક સજ્જન પાસે આવ્યા. તેમણે સીધો સવાલ કર્યો કે, મારો દિકરો મોડર્ન યુગનો માણસ છે તે નોનવેજ છે. તે બહારની હોટેલમાં જો માંસ-ભોજન કરે તો તેની તબિયત બગડવાની પૂરી શક્યતા છે. કેમકે માંસ રોગિષ્ઠ ઢોરોનું હોઈ શકે છે. રાંધવામાં કાચુ પણ રહી શકે છે. તો એના સુંદર આરોગ્ય ખાતર હું તેને મારે ઘરે નીરોગી પશુનું માંસ બરોબર રાંધીને ખવડાવું તો તેમાં તમારો શો અભિપ્રાય છે! બિચારા સજ્જન! શું જવાબ દે? કેટલીક બાબતો તો ગૃહીત જ બની ગઈ કે તે દીકરો માંસાહારી છે. માંસ ખાશે જ. સવાલ માત્ર બજારનું માંસ કે ઘરમાં રાંધેલું માંસ ખાવા અંગેનો જ છે.

ઉંચી ઈમારતેથી ભૂસકો મારીને નીચે પડવું તો છે જ, સવાલ એટલો જ છે કે સોળમાં માળેથી ઝંપલાવવું કે દશમાં માળેથી!

કેવો પ્રલયકાલીન વિનાશ વેરી રહ્યો છે, પશ્ચિમનો ઝંઝાવાતી પવન!

અમેરિકામાં પ્રિન્સીપાલને બાળકે કહ્યું : “હું મોટો થઈશ પછી મારા પપ્પા-મમ્મીને પીસ્તોલથી શૂટ કરી નાખીશ. કેમકે તેઓ મારું કોઈ ધ્યાન રાખતા નથી. તેઓ રજાના દિવસોમાં બહાર તાળું મારીને મને ઘરમાં બંધ કરીને રખડવા નીકળી પડે છે.”

ટુંકમાં ભારત જેવી સંસ્કૃતિ પશ્ચિમના દેશોમાં ન હોવાથી ત્યાં ઘણીબધી વિકૃતિઓ પેદા થઈ છે. ૭૦% જેટલા અપરિણીતો બધું સંસાર સુખ માણી બેઠા હોય ત્યાં સંસ્કૃતિની શી આશા રાખી શકાય?

પશ્ચિમની સંસ્કૃતિના વકીલ બની કેટલાક ભારતીય પાગલો લવારો કરતા હોય છે. પશ્ચિમદેશનાં લોકો તો ખૂબ સુઘડ અને સ્વચ્છ છે શિસ્તના પ્રેમી છે અને રૂપાળા છે.

જેઓ પોતાને સુધરેલ માને તેઓ શી રીતે સુધરેલા કહેવાય? આઠ-આઠ દિવસ સુધી સ્નાન જ ન કરે, સંડાસ ગયા બાદ મળશુધ્ધિ માટે પાણીને બદલે ટીશ્યુપેપર વાપરે એવા ગંદા માણસો! સુધરેલા!

અમારા ભારતના કહેવાતા જડ, બુધ્ધુ, ગામડિયા લોકો ભરપૂર પાણીથી જ મળશુધ્ધિ કરે છે. કાળી માટીથી સત્તર વખત હાથ ધુવે છે. સંડાસ ગયા પછી સ્નાન કરે છે. હાય! એ પછાત! ક્યાંનો આ ન્યાય!

આ ભારતીય પાગલોને ખબર નહિ હોય કે ત્યાંના કેટલાક લોકોને હજી પણ ડાબા



હાથે ખાવુ કે જમણા હાથે તેની પણ ગતાગમનથી.

બહારની ગોરી ચામડીના કારણે, રૂપાળા દેખાતા આ લોકો પસીના સુધી વ્યાપી ગયેલી અનાચારોની દુર્ગંધને ઢાંકી દેવા, કરોડો ડોલરના સેંટ-અત્તર અને જાત જાતના લોશનો વાપરી રહ્યા છે. તેની ખબર પણ આ પ્રશંસકોને નહિ હોય.

અમેરિકાની પ્રશંસા કરનારા લોકોએ બુધ્ધિનો ગણાતો પોતાના મગજનો ત્રીજો માળ અંગ્રેજોને ભાડે આપ્યો છે. તેથી જ તેણે પોતાની સ્વવિચાર શક્તિ ગુમાવી દીધી છે. અને વારંવાર પશ્ચિમના દેશોની જ પ્રશંસા કરતો રહે છે.

આફ્રિકા રાજ્યના પ્રમુખ કુમુલ બાન્દાએ લંડનની મુલાકાતથી પાછા ફર્યા બાદ પોતાના દેશવાસીઓને વાત કરતા જણાવ્યું હતું કે લંડનના યૌવનને મે જે બેફામ અને બેહાલ દશામાં જોયું છે એ જોયા પછી મને લાગે છે કે આ મેં ન જોયું હોત તો સાડા થાત, ક્યાં યુરોપ (લંડન) અને ક્યાં આફ્રિકા ?

એક વખત વિવેકાનંદ અમેરિકાની મુસાફરી કર્યા બાદ ભારતમાં પાછા આવ્યા, એક પશ્ચિમપરસ્ત ખબરપત્રી તેમની પાસે પહોંચી ગયો. તેના મનમાં હતું કે વિવેકાનંદ પરદેશ જઈ આવ્યા છે. તો ત્યાંની સભ્યતા, શિસ્ત અને વિવેક વગેરે જોયા જ હશે. એટલે ત્યાંના ખૂબ વખાણ કરશે. તેણે પૂછ્યું : “સ્વામીજી ! પરદેશની સંસ્કૃતિ અને ત્યાંની પ્રજા આપને કેવી લાગી ?”

વિવેકાનંદ સ્વામીએ જવાબ આપ્યો, પરદેશ ગયો ત્યારે ભારતના લોકો મને ચાહવા જેવા લાગતા હતા. પરંતુ ત્યાંનો અનુભવ લીધા પછી અહીં આવ્યા બાદ મને લાગ્યું કે આજ સુધી હું ભારતના લોકોને માત્ર ચાહતો જ હતો. પરંતુ હવે તો હું તેઓની પૂજા કરીશ. આ જવાબ સાંભળીને પેલો ખબરપત્રી સ્તબ્ધ થઈ ગયો.

આ જ વિવેકાનંદ અમેરિકામાં એક સભામાં ભારતની સંસ્કૃતિ અને ભારતના લોકોની મહાનતા વિષે ભાષણ આપતા હતાં. ત્યારે એક અંગ્રેજ બાઈ એકદમ ઊભી થઈ ગઈ. તેણીએ પૂછ્યું : “જો હિન્દુસ્તાનની જ સંસ્કૃતિ સર્વોત્તમ હોય તો તમે અમારા દેશના જોડા શા માટે પહેર્યા છે ?”

જડબાતોડ જવાબ આપતાં વિવેકાનંદે જણાવ્યું કે મેડમ! મેં જે ક્યું છે તે બરાબર છે. મારા માથા ઉપર મેં હિન્દુસ્તાની પાઘ બાંધી છે અને પગમાં અમેરિકન બુટ પહેરેલા છે. તેથી તમે સમજી જાઓ કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ અમારા માથા ઉપર છે અને તમારી સંસ્કૃતિ અમારા પગના તળિયે છે. અમારી પાસે તમારા લોકોનું સ્થાન જોડા બરાબર છે.

ક્યાં પરદેશોમાં જઈને પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે સિંહ ગર્જના કરતા એ

સ્વામી વિવેકાનંદ અને ક્યાં સ્વદેશમાં રહીને પણ પશ્ચિમની જ પ્રશંસા કરતા આજના શિક્ષિત ! અભણો !

આચાર અને સંસ્કારોની બાબતમાં સૌ દેશો માટે પ્રેરણામૂર્તિ જો કોઈ દેશ હોય તો તે એક માત્ર હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનની પાવન ધરતીના ગામડે ગામડામાંથી આજે પણ સંસ્કૃતિ સંસ્કાર અને સદાચાર ની સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી છે.

અમેરિકાના લોકો ઘરે આવેલા અતિથિને જાતે જ ફિંકમાં રાખી મુકેલું દિવસોનું વાસી શાક ગરમ કરી લેવા અને ખાઈ લેવા જણાવીને ઓફિસે ચાલ્યા જાય છે.

અ હો ! અમારા ભારતનો અતિથિ સત્કાર ! ધરના બધાય માણસો મહેમાન આવતા હરખ નીતરતા થઈ જાય, કેવું વહાલ કરે ! પધારો, પધારો... કેવા નેહભર્યા શબ્દોથી સત્કારે, મીઠાઈઓ વગેરેથી ભરપૂર કેવું ભોજન કરાવે ? “કાઠિયાવાડમાં ભૂલો પડ્ય ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા.” આ હિન્દુસ્તાની સંસ્કૃતિ છે.

પશ્ચિમી દેશના મહાન વિદ્વાન ગણાતા શેક્સપિયરને વિચાર આવ્યો કે આ મારી પત્નિ જ્યારે મરી જશે ત્યારે માડું શું થશે ? જાણે બાવરો બની જાય છે.

હવે અભણ છતા ભણેલા નરસિંહ મહેતાની વાત કરૂ. જુનાગઢના ચોરે તે નાયતા નાયતા ભજનો ગાતા હતા ત્યાં સમાચાર મળ્યા કે તેના પત્નિ વૈકુંઠવાસી થયા છે. તરત તેમણે ગાવા માંડ્યું ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ.

કેવો ઉઘાડો ફરક દેખાય છે બે સંસ્કૃતિ વચ્ચે... ! આ મહાન દેશની પ્રજાનો ઉછેર જ આગવી રીતનો છે.

આથી છે, આ ભારત મહાન !

આથી છે, આ પ્રજા મહાન !

આથી છે, આ સંસ્કૃતિ મહાન !

પશ્ચિમના દેશોના વગર પગારનાં વકીલ બની તેની પ્રશંસા કરવાનું હવે બંધ કરી દો, અને જેની આબોહવામાં સંસ્કૃતિ, સદાચાર અને સંસ્કારની સુવાસ ચોમેર ફેલાયેલી છે તેવા ભારત દેશની પ્રશંસા કરવાનું ચાલુ કરી દો.

‘તલવાર કી કિંમત ધાર સે હોતી હૈ ।

કપડે કી કિંમત તાર સે હોતી હૈ ।

દેશ કી કિંમત સદાચાર સે હોતી હૈ ।’

અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ...



વર્ણશ્રમધર્મ

- મહેશ મહેતા (સુરત)



શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના શ્લોક ૨૪માં પોતાના આશ્રિતોને આજ્ઞા કરે છે કે “પોતપોતાના વર્ણાશ્રમધર્મનો કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું.”

‘વર્ણાશ્રમ’ શબ્દમાં વર્ણ અને આશ્રમ એ બે શબ્દો સમાયેલા છે. વેદોમાં ચાર વર્ણ અને ચાર આશ્રમનું નિરૂપણ કરેલ છે. ચાર વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર અને ચાર આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ. બ્રાહ્મણના ધર્મમાં નાહી ધોઈને પવિત્રપણે રહેવું, સદાચારી જીવન, ધીરજપણું તથા ક્ષમાવાન પણું મુખ્ય છે. ક્ષત્રિયના ધર્મમાં શુરવીરતા-અન્ય ત્રણ વર્ણનું રક્ષણ કરવું મુખ્ય છે. વૈશ્યના ધર્મમાં વેપાર તથા ખેતીવાડી કરી અન્ન ઉત્પન્ન કરી આજીવિકા ચલાવવી તથા શુદ્રજાતિના લોકોએ ઉપરોક્ત ત્રણે વર્ણની સેવા કરવી એ મુખ્ય છે. એવી જ રીતે માનવીના જીવનમાં ચાર આશ્રમો છે. બ્રહ્મચર્યાશ્રમમાં ૨૫ વર્ષ સુધી રહી વિદ્યાભ્યાસ કરવો અને પોતાના ભાવિ જીવનનો પાયો મજબુત કરવો. ત્યારબાદ જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો ગૃહસ્થાશ્રમમાં પગલાં કરી પોતે પોતાના વર્ણ પ્રમાણેનો ઉદ્યમ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ ન્યાય અને નીતિથી પૈસા કમાઈને કરવું. ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી ગૃહસ્થજીવન ત્યાગી પ્રભુમય જીવન ગુજારવું. બન્ને પતિ-પત્નિએ પોતાના બાળકોને વ્યવહાર સોંપી સંસારની ઉપાધિઓથી રહિત થઈને વાનપ્રસ્થાશ્રમમાં જીવન ગુજારવું. ત્યારબાદ સન્યાસાશ્રમમાં એકાંતજીવન જીવી પ્રભુપ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરવો. બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરવાનો ઈશક રાખી અલમસ્ત જીવન જીવવું.

આત્મસત્તારૂપ થઈને પરમાત્મામય જીવન જીવવું. આજના કળિયુગમાં વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમમાં જંગલમાં જઈને એકાકી જીવન જીવવાનો નિષેધ છે પણ પોતે પાછી વૃત્તિ કરી પ્રભુમય જીવન જીવવું એ અર્થ ઘટાવવો. ગીતામાં કહ્યું છે કે :-

‘શ્રેયાન્ સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુષ્ઠિતાત્ ।

સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥’

ઉપરોક્ત ચાર વર્ણ અને ચાર આશ્રમધર્મમાં જે વ્યક્તિ રહે છે તે સુખી રહે છે. પરધર્મનું તેમજ પાખંડ ધર્મનું આચરણ ન કરવું તેમજ કલ્પિત ધર્મનું આચરણ ન કરવું.

પરધર્મ ભયાવહ, દુઃખકારી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ પણ કહે છે કે ગૃહસ્થના ધર્મ ત્યાગીને દૂષણરૂપ છે અને ત્યાગીના ધર્મ ગૃહસ્થને દૂષણરૂપ છે. ભગવા લૂગડા પહેરવા એ ગૃહસ્થને શોભારૂપ નથી તેમજ ભાતભાતની ડીઝાઈનવાળા વસ્ત્ર તથા સોના ચાંદીના અલંકાર પહેરવા તે ત્યાગીને દૂષણરૂપ છે. સાધુ મુંડન કરાવે તે શોભારૂપ છે જ્યારે ગૃહસ્થ મુંડન અમંગળ અવસર હોય તો જ કરાવે. ત્યાગીના ધર્મ ગૃહસ્થ માટે પરધર્મ છે અને ગૃહસ્થના ધર્મ ત્યાગી માટે પરધર્મ છે. ગીતામાં તેથીજ કહ્યું છે કે પોતાનો ધર્મ પાળતા પાળતા મરી જવું સાડું. “સ્વધર્મે નિધનં શ્રેયઃ”

હવે પાખંડ ધર્મ કોને કહેવાય ? પાપં સનોતિ ઇતિ પાખંડ જે વસ્તુ શાસ્ત્રમાં વર્ણવી ન હોય, પાપને પોષવા માટે તેમજ પોતાના દંભને સાચવવા માટે પોતાના કપટ તથા સ્વભાવને ઢાંકવા માટે આચરણ કરાય તથા જે આચરણને શાસ્ત્રનો, ધર્મનો ક્યાંય ટેકો ન હોય એને પાખંડ ધર્મ કહેવાય. પાખંડ લાંબુ ટકતું નથી.

પોતાની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલો ધર્મ, જેને મન ફાવે તેમ વર્તવું પણ કહી શકાય. શાસ્ત્ર વગરનું જીવન જેનું હોય અને પોતે જે આચરણ કરે તે ખોટું હોય તેને પણ સાચું ઠરાવવા પ્રયત્ન કરે. તર્ક અને દલીલબાજીમાં આવા લોકો પાવરધા હોય છે. આજે પાખંડ અને કલ્પિત ધર્મનું જોર બહું છે. આજે ધર્મ પાળનાર સત્સંગી કહેવાતા લોકો પણ અગીયારસને દિવસે ઉપવાસને બદલે ફળાહાર અને ફળાહારને બદલે અનેક સ્વાદીષ્ટ ફરાળ બનાવી ખાવું તેને કલ્પિત ધર્મનું આચરણ કહેવાય. જે લોકો ઈશ્વરમાં ન માનનારા નાસ્તિકો છે તેઓ તર્ક અને દલીલબાજી કરીને શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ખપાવે છે. અંધશ્રદ્ધા એટલે જ પાખંડધર્મ. જેમાં શાસ્ત્રનો નિયમ કે સંબંધ ના હોય તેવો વિશ્વાસ વગરનો ધર્મ તેને પાખંડ ધર્મ કે કલ્પિત ધર્મ કહેવાય છે. સત્સંગી ભક્તોને શ્રીજી મહારાજ આવા ધર્મ પાળવાની ના પાડે છે. વર્ણાશ્રમધર્મ પ્રમાણે જીવન જીવવાથી શ્રીજી મહારાજ રાજ થાય છે.





(પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના સત્સંગ
પ્રવચનમાંથી સંકલિત...)

ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા અંત્ય પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં કહે છે : “...જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે.” મન શ્રેષ્ઠ પદાર્થ શોધ્યા જ કરે છે. પરંતુ શ્રેષ્ઠ પદાર્થ શું છે ? તેનું જ્ઞાન નથી. તેથી બીજે ભટક્યા કરે છે, જો શ્રેષ્ઠ પદાર્થમાં દૃષ્ટિ પહોંચી જાય તો સુખ માટે એને ક્યાંય જવું પડતું નથી. અને એ સૌથી શ્રેષ્ઠ શું છે ? તેનું જ્ઞાન તો સત્સંગથી જ થાય છે.

આ જીવની અવળી મતિ છે, તે દુઃખી નથી મટતો એનું કારણ છે કે, ‘જ્યાં સુધી પોતાથી શ્રેષ્ઠ કોઈ ન દેખાય ત્યાં સુધી સુખ અને આનંદ રહેશે. પરંતુ જ્યારે પોતાથી શ્રેષ્ઠ વસ્તુ જણાશે ત્યારે અસંતોષ થઈ જાય છે અને દુઃખી દુઃખી થઈ જાય છે.’

સર્વથી શ્રેષ્ઠ વસ્તુ તો એક ભગવાન જ છે. પરંતુ આ ઓળખાણ તો સત્સંગથી જ થાય. સત્સંગ થવો એ વાત બહુ ગહન છે. રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે :

‘जनम जनम मुनि जतनु कराई ।

अंत समे राम आवत नांही ॥’ (રામાયણ)

ઋષિમુનિઓ જન્મોજન્મ સુધી અનેક પ્રકારની તપશ્ચર્યા કરે તોપણ અંતસમે પરમાત્માના દર્શન થવા ઘણા દુર્લભ છે. આ જ વાતને સ.ગુ. શતાનંદ સ્વામી શ્રીમદ્ સત્સંગિજીવનમાં કહે છે :

‘एतदर्थं जहू राज्यं महान्तश्चक्रवर्तिनः ।

उग्रं तपश्च कुर्वन्ति त्यक्तगेहा विवेकिनः ॥’

(સત્સંગિજીવન : અ. ૧ શ્લો. ૫૦)

અર્થાત્ ‘ભગવાનના દર્શન માટે તો મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ પણ રાજ્યવૈભવનો ત્યાગ કર્યો છે. ઘરબારનો ત્યાગ કર્યો છે. તેમજ આત્માઅનાત્માનો વિવેક પ્રાપ્ત કરી ઉગ્ર તપશ્ચર્યા કરી છે.’

આ સુખ અતિ ગહન છે. આવું જીવ જ્યારે સાંભળે છે ત્યારે હિંમત હારી જાય છે. પરંતુ જેમસરકાર દ્વારા યા તો કોઈ કંપની દ્વારા અલગ અલગ રીતે સ્કીમો કરવામાં આવે છે. જો તે સ્કીમ જેના હાથમાં આવી જાય તો તે ન્યાલ થઈ જાય. અભણ હોય કે ભણેલ હોય, ઓફિસર હોય કે ગામડાંનો ખેડુત માનવ હોય, ગમે તે હોય આ સ્કીમનો લાભ તો સર્વે કોઈ લઈ શકે છે. પરંતુ ગામડાંનાં અભણ માણસો તો બિચારા હાથમાં

જીવના કલ્યાણનું અજોડ,

સરળ અને આવશ્યક સાધન.....

ભગવદીયનો પક્ષ

કોદાળી પછાડ્યા કરે છે, આ સ્કીમ તેના પણ સુખ માટે છે. જો તેમના હાથમાં આ સ્કીમ આવે તો કરોડપતિ બનતા વાર ન લાગે. પરંતુ એમાં એમને કાંઈ ગમ પડે નહિ તેથી તે સ્કીમથી તે વંછિત રહી જાય છે.

તેવી જ રીતે આત્યંતિક કલ્યાણ (મોક્ષ) કરવો એ મહાગહન છે. તેની સાબિતી આપતાં શ્રીજીમહારાજ ગઢડા અંત્ય પ્રકરણના છેલ્લા વચનામૃતમાં કહે છે : “...જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી.” એટલાં બધાં જન્મ લીધાં તોપણ મોક્ષને તો પામ્યો જ નહિ. માટે મોક્ષ કરવો એ બહુજ ગહન છે. તેમાં ભગવાનના રાજીપા રૂપી સ્કીમ બહુ જ સહેલી છે. જેમકે ભાલની બીબડી. તેણે બીજું કાંઈ પણ કર્યું નહિ ફક્ત શ્રીજીમહારાજને પોતાના અંતરના પૂરાં ભાવથી દાતણ આપ્યું. અને તે દાતણની સેવાથી ભગવાન શ્રીહરિ રાજી થઈ ગયા તો તેનું સદ્. મુક્તાનંદ સ્વામી જેવું શ્રીજીમહારાજે કલ્યાણ કર્યું. હવે આ વાતમાં ‘જનમ જનમ મુનિ જતનુ કરાઈ’ ને ક્યાં મેળ બેસે? પરંતુ અંતરનો રાજીપો મળવો એ અજોડ વસ્તુ છે.

હવે પ્રશ્ન એ થાય કે ભગવાન રાજી કેમ થાય?

એક બાજુ ગોસ્વામી તુલસીદાસજી લખે છે :

‘જનમ જનમ મુનિ જતનુ કરાઈ । અંત સમે રામ આવત નાંહી ।।’

પરંતુ જે વખતે જટાયુએ દેહત્યાગ કર્યો ત્યારે એ જ તુલસીદાસજીએ પોતાની કલમે લખ્યું :

‘ગીઘ અધમ યગ આમીશ ભોગી । ગતિ દિન્હી જિન્હે જાચત જોગી ।।’

આટલું લખ્યાં પછી પણ ગોસ્વામી તુલસીદાસજીને સંતોષ ન થયો અને લખ્યું :

‘ગીઘ દેહ તજી ઘરી હરિરુપા । ભૂષણ બહુ પટપીત અનુપા ।।’

આની પાછળનું કારણ શું? તો એમણે બરાબર સમયે જ એક સ્કીમ ઝડપી!

શ્રીજીમહારાજ ગઢડા અંત્ય પ્રકરણના સાતમા વચનામૃતમાં કહે છે : “...ભગવાનના ભક્તનો પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, માન થાઓ કે અપમાન થાઓ, અથવા જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મુકવો નહિ...”

વળી, ભક્તનો પક્ષ રાખવાથી પંચમહાપાપ બળી જાય તેવું જણાવતાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણના ૬૦મા વચનામૃતમાં કહે છે : “અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે , ‘તેનાં બ્રહ્મહત્યાદિક જે

પંચમહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે.’...”

કેટલી સરળ સ્કીમ!!!

એક બાજુ શરણાગતિ પામ્યા સિવાય જીવનો મોક્ષ શક્ય છે જ નહિ, અને બીજી બાજુ ગુંદાળી ગામના બે કાઠી ભાઈઓએ કંઠી પણ ધારણ નહોતી કરી, શ્રીજીમહારાજના દર્શન પણ કર્યા ન હતાં, તેમ છતાંય મામાના સાધુ છે તેમ જાણીને સંતોનો પક્ષ રાખ્યો તો મહારાજ તેમને પોતાના ધામમાં તેડી ગયા.

પક્ષ રાખતા સફળ થાઓ, અથવા નિષ્ફળ થાઓ. ગીધ ક્યાં સફળ થયું હતું? એનો હેતુ મા જાનકીજીની રક્ષા કરવાનો હતો. તે તો સિદ્ધ થયો જ નહોતો, અને દેહ પડી ગયો હતો. એ લંકેશ્વરનું બળ જાણતો હતો કે અહિં ‘હું સફળ નહિ થાઉં’ છતાં હું હિન્દુસ્તાનનું પ્રાણી છું અને એક અબળાની આબરૂ જતી હોય ત્યાં સુધી હું બેસી રહું? લંકેશ્વરી રાવણ સામે લડ્યો છે છતાં નિષ્ફળ ગયો ને ભોંય ઉપર પછાડ્યો અને પારાવાર દુઃખ પામ્યો.

આટલો મા જાનકીજીનો પક્ષ રાખ્યો તો તમે કલ્પના કરો...

અવધપતિ રાજા દશરથનો અગ્નિસંસ્કાર પ્રભુ રાઘવે પોતે નહોતો કર્યો અને અધમગીધ પક્ષીનો અગ્નિસંસ્કાર પ્રભુ રાઘવે પોતે કર્યો!!!

આવો જ પ્રસંગ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી કંડારવામાં આવ્યો છે.

તે પ્રસંગ છે પંચાળા નરેશ જણાભાઈનો.

જણાભાઈએ બિમાર કમળશી ભક્તનો પક્ષ રાખતાં પોતાના સગા બહેન અદીબા સાથે અબોલા કર્યા. આટલા પક્ષથી શ્રીજીમહારાજ રાજી થઈ ગયા ને પોતાનાં સગા ભાઈ ઈચ્છારામજી મહારાજની નનામી મહારાજે પોતે હયાત હોવા છતાંય ઉપાડી નહોતી અને જણાભાઈની નનામી ખુદ મહારાજે ઉપાડી.

પક્ષ રાખતાં કેટલો રાજીપો!

ભગવાન શ્રીહરિએ વચનામૃતમાં નિયમ-નિશ્ચય અને પક્ષની વાત કરી છે : તેમાં નિયમપાળવા અને પછી મોક્ષ થવો જીવ માટે થોડો કઠણ પડે. પરંતુ નિયમ-નિશ્ચય કરતાં પક્ષ મોક્ષમાર્ગમાં મેદાન મારી જાય છે. કારણ કે નિયમઅને નિશ્ચય રાખવામાં આબરૂ જતી નથી. પરંતુ પક્ષ રાખતાં તો અપમાન થાય, બેઆબરૂ થવું પડે, કોઈનો માર સહન કરવો પડે. માટે પક્ષ નામની સ્કીમમાં શ્રીજીમહારાજે બહું ડિસ્કાઉન્ટ આપ્યું છે.

સાધનથી જીવનું કલ્યાણ થવું શક્ય છે જ

અનુસંધાન પાન નં. ૧૭ પર

શ્રી સ્વામિનારાયણ ચિંતન ✽ મે - ૨૦૦૭





-: સામાન્ય મર્યાદા :-

જેમગૃહસ્થ ત્યાગીની સેવા કરે છે તેમત્યાગીએ પણ હરિભક્તનું માહાત્મ્ય જાણવું જોઈએ. “ગૃહસ્થ અન્ન-વસ્ત્રે કરીને આપણી ચાકરી કરે છે તેમઆપણે એમનું માહાત્મ્ય સમજીને એમની કથા વાર્તાએ કરીને ચાકરી કરવી. એમઅરસ-પરસ મહિમા સમજીને હરિભક્તની સોબત રાખવી.” (વચ. ગ.મ.-૪૭)

જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, એની આગળ તો માન રાખવું તે જ સાડું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તે જ રૂઝું છે. (વચનામૃત પંચાળા-પ)

જે દેશમાં રહ્યે થકે પોતાના દેહનાં સંબંધીનો વારંવાર બેઠા ઊઠવાનો યોગ થતો હોય તો તે દેશમાં ન રહેવું. અમારા દર્શન થતા હોય ને તે ભેળે સ્ત્રીઓનાં દર્શન થતાં હોય એવો સંગ તથા ક્રિયા તજી દેવી, કોઈક મિષ ળઈને ઊઠી જવું. જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકૂટ થતી હોય ત્યાંથી ચાલી નીકળવું પણ તે ઠેકાણે રહીને માર ન ખાવો. (આ આજ્ઞા વિશેષ ત્યાગી માટે છે) (વચનામૃત લોયા-૬)

જે પુરૂષ જેવા ગુણવાળો હોય, તે પુરૂષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથા યોગ્ય બોલાવવો. (શિ. શ્લો.-૬૮)

કોઈની પણ ગુહ્ય (છાની) વાત કોઈ ઠેકાણે પ્રગટ ન કરવી. જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.

(શિ. શ્લો.-૭૫)

હરિભક્તને માંહોમાંહિ બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશય ભૂંડુ છે. (વ. ગ.અં.-૨૫)

સળગતી દિવાસળી કે કોલસા સડક પર કે ક્યાંય ફેંકવા નહિ.

જ્યાં જવાની મનાઈ હોય કે તાર બાંધેલા હોય તેવા રસ્તે ન જવું.

ચોર માર્ગે કરી પેસવું નહીં અને નિસરવું નહીં. જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.

(શિ. શ્લો.-૩૩)

ઓફિસ-કચેરી આદિકમાં કોઈને મળવા જવું ત્યારે ઘણા વ્યક્તિને સાથે ન લઈ જવા.

કોઈના ઘરે ભોજન કે ઉંઘવાના સમયે ન જવું.

કોઈએ ચોરનું કર્મ ન કરવું. ધણિયાતું કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ પણ

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત

સાંપ્રદાયિક બંધારણીય સ્થિતિ મુજબ...

હરિભક્તોને વત્યાની રીતિ :

સ્વામી આનંદસ્વરૂપદાસજી - સરધાર

તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. (શિ. શ્લો.-૧૭)

સભામાં માણસ બેઠા હોય ત્યાંથી વચ્ચેથી ન જતાં પાછળથી જવું. વચ્ચેથી જવાનું થાય તો નીચા નમી ક્ષમા માંગીને જવું.

પંક્તિમાં બધાએ ભોજન સાથે શરૂ કરવું, સાથે ઊઠવું. જલ્દી ઊઠીએ તો રજા લઈને ઊઠવું. એંઠી થાળી અગર પાત્ર હઠાવી લેવું, જેથી જમનારને સુગ ન ચઢે. જમતી વેળાએ એહું મુકી રાખવું નહિ. પડ્યું રહે તેટલા પ્રમાણમાં લેવું નહિ અન્નનો બગાડ કરવો નહિ. પીરસનારાએ જમનારની શક્તિ જોઈને પીરસવું. એહું મુકવાથી અન્નદેવનો અપરાધ થાય છે. જમતાં પહેલાં ભગવાનની માનસી પૂજા કરવી.

સભામાં છીંક કે ઉધરસ આવે તો મોઢા પર હાથ કે રૂમાલ રાખવો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું. કારણ કે એક છીંક બાવાથી ત્રણ લાખથી વધારે બેક્ટેરિયા બહાર નીકળે છે, માટે તે વખતે હરિસ્મરણ પરાયણ થવું.

હોટલના ચા-પાણી-નાસ્તો જમવા નહિ.

બહારગામ જવાના પ્રસંગ સિવાય સવારે ૩-૦૦ વાગ્યા પહેલાં સ્નાન પૂજા ન કરવી, કેમકે તે રાત્રિ સ્નાન કહેવાય છે.

તિલક ચાંદલો અવશ્ય કરવો. કેમકે તિલક ચાંદલો કયા વિના દર્શન, પૂજા કે સત્કર્મને ભગવાન સ્વીકારતા નથી.

ગુપ્તદાન મહાદાન છે. પુણ્ય કે પાપ જાહેર કરવાથી તેનો નાશ થાય છે.

આવકનો દશમો અથવા વિશમો ભાગ દેવને બિનશરતી અર્પણ કરવો. પોતાના વિભાગમાં જ્યાં રહેઠાણ તથા ધંધો હોય તેવા શિખરબધ્ધ મંદિરમાં ધર્માદો આપવો. ધર્માદો પોતાની ઈચ્છા અનુસાર ગમે તે મંદિરે કે અન્ય સંસ્થાઓમાં આપી શકાય નહિ. કેમકે તે દેવના ભાગનું દ્રવ્ય છે. તેનો ઉપયોગ કરવાનો આપણને કોઈ હક્ક નથી.

રસોઈ કે થાળ જેવા બર્યાઓ ધર્માદાની રકમમાંથી કરવા નહિ. કેટલાક ગામમાં દેવનો ધર્માદો ભેગો કરીને રસોઈ બનાવી પ્રેમથી જમે અને તેમકરતાં બચેલી રકમ ધર્માદા નિમિત્તે મંદિરે આપે છે. તે યોગ્ય નથી.

વર્ષના અંત સુધીમાં ધર્માદાની રકમ જમા કરાવવી.

વડતાલ દેશના હરિભક્ત અમદાવાદ દેશમાં સહપરિવાર રહીને ધંધો ઉદ્યમ કરતા હોય તો અમદાવાદના મંદિરમાં ધર્માદો આપવો અને અમદાવાદ દેશના હરિભક્ત સહપરિવાર વડતાલ દેશમાં રહેતા હોય તો વડતાલ દેશમાં ધર્માદો આપવો.

વળતર લીધા સિવાય બિનશરતી દેવના કોઠારે ધર્માદાની રકમ જમા કરાવવી.

દેવનો ધર્માદો ચોખ્ખો નહિ આપનાર માણસ વ્યવહારે કરીને હંમેશા દુઃખી રહે છે.

ધર્માદાની રકમ સત્સંગીઓ પાસેથી એકત્ર કરીને ટ્રસ્ટ કે મંડળ બનાવીને વહીવટ કરવાનો અધિકાર શ્રીજી મહારાજે પ.પૂ. ધ.ધુ. મહારાજશ્રી સિવાય કોઈનેય આપ્યો નથી.

ધર્માદાની દશમા વિશમા ભાગની ગણતરી માટે જણાવવાનું કે પોતાનો ધંધો, ખેતી, વેપારની બચત રકમમાંથી દશમો વિશમો ભાગ ગણવો. ધંધાની ઉપજમાં કાયદેસરનું ધંધાકીય ખર્ચ બાદ કરીને બાકી રહેલ રકમને બચત અથવા આવક કહેવાય છે. તેમાં વ્યાવહારિક તથા ઘર ખર્ચનો સમાવેશ થતો નથી.

દશમો ભાગ એટલે દશ ટકા અને વિશમો ભાગ એટલે પાંચ ટકા ગણાય છે. જે શ્રીહરિને અર્પણ કરવાથી દેવજ્ઞામાંથી મુક્તિ મળે છે. તે અખિલેશ્વરની મર્યાદાઓના નિયમો શ્રીહરિના ભક્તોને હાલમાં આવશ્યક ઉપયોગી જાણી સંગ્રહરૂપે પ્રસ્તુત શિક્ષામૃત સાથે સંકલિત કરેલ છે. તેને અનુસરી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાના સુપાત્ર બની રહિએ એજ આકાંક્ષા સહ અભ્યર્થના.....

અનુસંધાન પાન નં. ૧૫ પરનું

નહિ. સમયે જેણે રાજીપો પ્રાપ્ત કરી લીધો તે કામ કરી ગયા છે, અને મોક્ષનો પથ સર કરી ચૂક્યા છે. પરંતુ જીવ નબળો બહુ છે, થોડાકમાં હિંમત હારી જાય છે કે આપણાથી તે ન થાય.

કોઈ એક જગ્યાએ બોર કરતાં હતાં. ૩૫૦ ફૂટ ગયો પણ પાણી ન થયું. તેથી બધા હિંમત હારી ગયા. એક વૃદ્ધ વડીલે હિંમત રાખી અને કહ્યું: “હજુ ૨૫ ફૂટ ઊંડો જવા દો, બોર કરવાનું ચાલુ રાખો. રૂપિયા હું આપી દઈશ.” તેથી બધાએ મને-કમને બોર ઊંડો નાંખ્યો. ત્યાં તો ૭ ફૂટમાં જ પાણી આવ્યું. આમ ૭ ફૂટ માટે ૩૫૦ ફૂટ બોર ફેલ થાત. માટે આપણે પણ ૭ ફૂટ બાકી હોય ત્યાં હિંમત હારીને બેસી જઈએ છીએ. પરંતુ ઘણું કર્યું તેમાં ૭ ફૂટ માટે બાકી ન રાખવું. આ દેહે કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ.પૂ. આચાર્યજી મહારાજશ્રી અને તેમને વ્હાલા એવા સંતો-ભક્તોને માટે જે થાય તે કરી છૂટવું તો અંતકાળે શ્રીજીમહારાજ જરૂર પોતાના ધામમાં તેડી જશે. માટે મોક્ષમાર્ગમાં હિંમત હારવી જ નહિ.



વચનામૃતમાં સદ્. મૂળજી બ્રહ્મચારી :

શ્રીજીમહારાજે પોતાની પરાવાણી વચનામૃતમાં જેમને અચૂક સંભાર્યા છે, જેમનું સ્થાન શ્રીહરિની જીભે વસી ગયું હતું તેવા દૃઢ નિષ્કામી સદ્. મૂળજી બ્રહ્મચારી (મુકુંદ વર્ણી)ના આદર્શ સદ્ગુણોને વચનામૃતના અક્ષરશઃ શબ્દો દ્વારા માણીએ...

❖“...આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે, અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’...”

(વચ. પ્ર. ૭૩)

❖“...અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલોખાયર આદિક જે હરિજન છે તે કેટલાંક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, ‘મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંઘાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે...”

(વચ. કા. ૬)

❖“...જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી અઢાર સંતો-ભક્તોના નામ એકબીજા કેડે કહ્યાં. તેમાં મૂળજી બ્રહ્મચારીએ પણ ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તે વિસ્તારીને કહેતા હવા...”

(વચ. લો. ૩)

❖“...આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દૃઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવાયાકરી કરે તો તે એવી ગમતી નથી...”

(વચ. મ. ૩૩)

❖“...જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ...”

(વચ. મ. ૪૭)

વચનામૃતમાં ભગવાન શ્રીહરિની પરાવાણી

સંયુક્ત આદર્શ ભક્તગાથાનો રસથાળ....

શ્રી જી મહારાજના નિષ્કામી સંગાથી...

સદ્. મૂળજી બ્રહ્મચારી

❖ “...અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે...”

(વચ. મ. ૫૨)

❖ “...મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાહ્યા છે ? પણ કલ્યાણનો ખપ અતિશય છે; માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતાં આવડે છે ખરું...”

(વચ. અમ. ૩)

❖ “...જેમ મયારામભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાટિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહિ...”

(વચ. મ. ૪૭)

સદ્. મૂળજી બ્રહ્મચારી એક પરિચય :

“મહારાજ, તમારી જોડ કોણ ?”

એક સમયે શ્રીજીમહારાજ સંતોની જોડ બાંધતા હતાં. આવવા-જવામાં સાથે રહેવું એવો સંતોને નિયમઆપ્યો તેમએમની જોડ પણ બાંધી હતી. ત્યારે કોઈ સાધુએ વિનોદ કર્યો. એમણે સૌની વચ્ચે મહારાજને પૂછ્યું : “સાધુ તો તમે પણ છો ને વળી સૌના આદર્શ છો, ગુરુ છો. તમારી જોડે શોભે એવો સાધુ કોણ છે ? તેને આજે ઓળખાવો. અમે પણ જાણીએ કે મહારાજની જોડ થવું હોય તેમણે એવા થવું જોઈએ.”

નદી-તળાવે શ્રીજીમહારાજ પોતે મન મૂકીને સૌની સાથે ભળતા, પંક્તિમાં આગ્રહ કરીને જમાડતા, સભામાં પ્રશ્નો પૂછતા ને ઉત્તર દેવા નાના-મોટા સંતોને પ્રેરણા કરતા, ક્યારેક જળકિંડા આદિકથી ગુલતાન કરી દેતા, બધાય એમ જાણે કે એક ડાળનાં પંખી હોય તેમ રહેતા, કિલ્લોલ કરતા. જોડ બંધાય તે નવું લાગ્યું એટલે એમાંથી પ્રશ્ન ઉપજ્યો.

પરંતુ કેવો પ્રશ્ન ? જેમનામાં અવતારોનાં અવતારી જોયા હતા, તેમની જોડ કેમ હોય ? ભગવાન જેવા એક ભગવાન જ છે, એમને જોડની જરૂર નથી. અવતારોએ તો સીતા ને સત્યભામા, રાધા ને લક્ષ્મી જેવી જોડ બાંધેલી. પરંતુ સાધુરૂપ લઈને બ્રહ્મચારી થઈ એકલા જ ભારતભરમાં ફર્યા એમની જોડ ક્યાંથી હોય ?

એમ છતાં સત્સંગે જાણ્યું છે કે વખતોવખત શ્રીજીમહારાજની જોડે ખાસ કરીને કોઈ રહેતા. ઘણી જગ્યાએ મુક્તાનંદ સ્વામી જોડમાં રહેતાં. તેઓ મહારાજના પંત(પંડિત)પ્રતિનિધિ ગણાતા, મહારાજ પણ પૂછતા ને પૂછાવતા. શુકાનંદ સ્વામી પણ લલિયા તરીકે જોડમાં રહેતાં. ગોપાળાનંદ સ્વામી તો અનાદિના સંગાથી છે એ એમનાથી છેટા છે એવી કોઈને શંકા જ નહોતી.

પરબ્રહ્મની સાથે બ્રહ્મરૂપ અનંત અક્ષરમુક્તોએ આ લોકમાં

અવતરણ કર્યું અને પોતે નિયમો કર્યા ને પોતે પણ પાળ્યા. પોતે બીજા કરતાં ઐશ્વર્ય-શક્તિ તો ઘણી વાપરી. પરંતુ રહ્યાં તો સૌની જેમ જ. એમને કોઈ સાધના કરવાની રહી નહોતી પણ સાધકના બધા ધર્મો પાળીને રહ્યા. અને જે જે કર્યું તે બીજા કરતાં ઉત્તમ જ કર્યું.

જીવમાત્રના ખરા સંગાથી ભગવાન છે, હરિ વિના જીવનો સંગાથી કોઈ નથી. પણ ભગવાન શ્રીહરિના સંગાથી કોણ ?

શ્રીજીમહારાજે જોડ બાંધી તે પણ ઉત્તમ બાંધી. બહુ હર્ષથી સંતોના પ્રશ્નનો ઉત્તર આપતાં મહારાજે કહ્યું : “મૂળાનંદ ને સહજાનંદ, આ બેની જોડ !”

એ ઉત્તરમાં મહારાજે મૂળાનંદને પહેલા મૂક્યા. પોતે પછી રહ્યા.

મૂળાનંદ ? એ કોણ ? એમને તો ઓળખવા જ જોઈએ.

મછિયાવ ગામના ઔદિચ્ય બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ. પિતા યજમાનવૃત્તિ કરે. ગોરપદુ કરી પોતાની આજીવિકા ચલાવતા આ કુંટુંબમાં બાળક જન્મ્યો. તેનું નામ મૂળજી રાખ્યું.

આ મૂળજી બાળપણથી ધાર્મિક વૃત્તિનો, સ્વભાવમાં વૈરાગ્ય ભરેલો, ભગવાનને મળવાની ધગશ લાગેલી. છોકરાઓ સાથે રમવાનું એને ગમે નહિ, એકાકીથકા જ ફરતા રહે. આઠમાં વર્ષે જનોઈ દીધી. પણ મૂળજી ઝાઝું ભણ્યો નહિ. મોટા થયાં એટલે પિતાજીના ધંધામાં એમને ભેળવી દીધાં. આ ગામથી બીજે ગામફરવા માંડ્યા. સંસારીઓને હજાર કામમાં ગોરદેવતાની જરૂર પડે. એ રખડપટ્ટીમાં મૂળજીના અંગની શોભા ફૂટી નીકળી. જોતજોતામાં રૂપાળો જુવાન બની ગયો.

એક સમયે એમને પરગામનું કામ સોંપાયું. યજમાનની દીકરીને સાસરેથી પિયર લઈ આવવા એમને મોકલ્યા. સાસરેથી બાઈને મૂળજીભાઈ સાથે રવાના કરી. સૌએ એમને વિનંતી કરી. “સંભાળીને લઈ જજો” અને મૂળજીભાઈએ ધરપત આપી. “તમે કશી ફિકર કરશો નહિ.”


રસ્તે રાત રોકાવાનું થયું. ધર્મશાળાની ઓરડીમાં બાઈને સુવાડી મૂળજી બહાર સુતા. પરંતુ મધરાત થતાં એમને લાગ્યું કે કોઈનો સ્પર્શ થયો છે. હેતથી હાથ ફેરવીને તેમને જગાડે છે. મૂળજી ઝબકીને જાગ્યા અને લાગેલો એમનો વૈરાગ્ય પણ જાગ્યો. બોલી ઉઠ્યા, “જો બહેન, અહીં કશી ભીતિ નથી. નિરાંતે સૂઈજા.” એમએમણે બાઈને અંદર વિદાય કરીને ભરોસાનું વચન કહ્યું, ‘હું જાગતો રહીશ, તું નિરાંતે ઉઘી જા.’ એમણે કમાડ આડું કર્યું ને પોતાની જગ્યામાં પડ્યાં એવામાં ઘસઘસાટ ઉઘી ગયા.

થોડીવારે મૂળજીનાં અંગ ઉપર સ્ત્રીનો હાથ ફરીથી ફરવા લાગ્યો ને વગર બોલ્યે કહી રહ્યો કે આવા ઠંડા હાથ ક્યાંથી ? મૂળજી મામલો પામી ગયાં, ઝટ લઈને દૂર ખસી ગયા. જે

અનુસંધાન પાન નં. ૯ પર

શ્રી સ્વામિનારાયણ ચિંતન ❖ મે - ૨૦૦૭





સત્સંગ સમાચાર પત્રિકા

અહેવાલ :- સ્વામી ધનશ્યામદાસજી - રઘુવીરવાડી-વડતાલ તથા સાધુ અમૃતસ્વરૂપદાસ - સરધાર

ખાખરીયામાં યોજાયેલ કથા-પારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

પાલીતાણા તાલુકાના ખાખરીયાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૧-૪-૦૭ થી તા. ૧૭-૪-૦૭ સુધી સત્સંગ સમાજ - ખાખરીયા આયોજીત ખોપાળા નિવાસી પૂ.સદ્. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજીના કૃપાપાત્ર શિષ્ય પૂ. સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું

આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ધનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તા. ૧૬-૪-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. સૌપ્રથમ તેઓશ્રીનું સ્વાગત ભવ્ય શોભાયાત્રા ગામના ભાગોળેથી કથાસ્થળ સુધી કાઢી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરમાં વિરાજમાન ઠાકોરજીની પ.પૂ. લાલજી

મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓનું પૂ. સંતો તેમજ યજમાનશ્રી દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સદ્. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી, પૂ. સદ્. સ્વામી શ્રી ભક્તિસંભવદાસજી, પૂ. મુક્તસ્વરૂપ સ્વામી - ખોપાળા, પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

આંબલીયાળામાં યોજાયેલ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

તારાપુર તાલુકાના પીપલોદ ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૮-૪-૦૭ના રોજ સવારે ૮ થી ૧૨ સુધી ભવ્ય સત્સંગ

સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. તેઓશ્રીનું ગામના ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભા મંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીને સંતો-ભક્તોએ પુષ્પમાળા અર્પણ કરીને આવકાર્યા હતા.

પૂ. પુરાણી સ્વામી, પૂ. વકીલ સ્વામી, પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. સર્વમંગલ સ્વામી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

પીપલોદને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીની દિવ્ય સંજ્ઞિધિમાં યોજાયેલ સત્સંગ સભા

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૮-૪-૦૭ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં

વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. તેઓશ્રીનું ગામના ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભા મંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીને સંતો-ભક્તોએ પુષ્પમાળા અર્પણ કરીને આવકાર્યા હતા.

પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી.

ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

સત્સંગ સભાની પૂર્ણાહુતિ કરીને બરાબર ૪.૦૦ કલાકે પ.પૂ. લાલજી મહારાજશ્રી ગોધરા પધાર્યા હતા. પ.ભ. શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના ત્યાં યોજાયેલ હોમાત્મક મહાપૂજાની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી પૂર્ણાહુતિ કરી હતી. ત્યારબાદ યજમાન પરિવારને આશીર્વાદ પાઠવી વિદાય થયા હતા.



આણંદમાં યોજાયેલ હોમાત્મક મહાપૂજામાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

તા. ૧૯-૪-૦૭ના રોજ આણંદ ખાતે પ.ભ. શ્રી અશોકભાઈ પટેલ (ખાંધલી) તથા પ.ભ. શ્રી હરજીભાઈ ભીમાણી (ચેરમેનશ્રી - ગઢપુર)ના નૂતન મકાનમાં નિવાસસ્થાન પ્રસંગે હોમાત્મક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહાપૂજામાં સાંજે ૬.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. તેઓ શ્રીનું બંને

યજમાનશ્રીઓએ પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ.પૂ. લાલજી મહારાજશ્રીએ હોમાત્મક મહાપૂજામાં શ્રીફળ બીડું હોમીને મહાપૂજાની પૂર્ણાહુતિ કરી હતી અને યજમાન પરિવારને રૂડા આશીર્વાદ પાઠવીને વિદાય થયા હતા.

રાત્રે ૧૦.૦૦ કલાકે વિરસદ ભજન મંડળ દ્વારા યોજાયેલ ધૂન-કીર્તન પ્રસંગે ફરીને પ.પૂ.

લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. અને પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપી સહુ ભક્તજનોને સુખીયા કર્યા હતા.

આ પ્રસંગે ગઢપુરથી પૂ. એસ.પી. સ્વામી, પૂ. કોઠારી સ્વામી, પૂ. પુરાણી સ્વામી, પૂ. વકીલ સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. સર્વમંગલ સ્વામી વગેરે સંતો પધાર્યા હતા.

ખસમાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

રાણપુર તાલુકાના ખસ ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૯-૪-૦૭ થી તા. ૨૩-૪-૦૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખોપાળા નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજીના કૃપાપાત્ર શિષ્ય પૂ. સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ઘનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક,

અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

શોભાયાત્રા

આ પ્રસંગે તા. ૨૨-૪-૦૭ના રોજ સવારે ૮.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા. ગામના ભાગોળથી પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને કથાસ્થળે શોભાયાત્રા વિરામપામી હતી.

ત્યારબાદ સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ. એસ.પી., સ્વામી, પૂ. ભક્તિસંભવ સ્વામી, પૂ. પૂર્ણસ્વરૂપ સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો-

ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

મૂર્તિ પ્રતિષ્ઠા

તા. ૨૩-૨-૦૭ના રોજ સવારે શુભ મુહૂર્તમાં નૂતન મંદિરમાં શુભ મુહૂર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયા પછી શ્રીહરિ યાગ યજ્ઞમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. શ્રીફળ બીડું હોમી મહોત્સવ શ્રીહરિ યાગ યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી.

સાલેયા ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

બોટાદ તાલુકાના સાલોયા ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૯-૪-૦૭ થી તા. ૨૩-૪-૦૭ સુધી ગઢપુરના પૂ. સ્વામી શ્રી માધવપ્રસાદદાસજીના માર્ગદર્શન પ્રમાણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા

આ પ્રસંગે તા. ૨૨-૪-૦૭ના રોજ બપોરે ૩.૩૦ વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

પધાર્યા હતા. ગામના ભાગોળથી પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને કથાસ્થળે શોભાયાત્રા વિરામપામી હતી.

ત્યારબાદ સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ. એસ.પી., સ્વામી, પૂ. ભક્તિસંભવ સ્વામી, તથા પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો-ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા

હતા.

મૂર્તિ પ્રતિષ્ઠા

તા. ૨૩-૨-૦૭ના રોજ સવારે શુભ મુહૂર્તમાં નૂતન મંદિરમાં શુભ મુહૂર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયા પછી શ્રીહરિ યાગ યજ્ઞમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. શ્રીફળ બીડું હોમી મહોત્સવ શ્રીહરિ યાગ યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી.



નાના મુંજ્યાસરમાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

બગસરા તાલુકાના નાના મુંજ્યાસર ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી અને સરધાર નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના સંપૂર્ણ સાથ સહકારથી તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૧૯-૪-૦૭ થી તા. ૨૩-૪-૦૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ધનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

શોભાયાત્રા

આ પ્રસંગે તા. ૨૩-૪-૦૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા. ગામના ભાગોળથી પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને મંદિરે શોભાયાત્રા વિરામપામી હતી.

ત્યારબાદ પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ

પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

ત્યારપછી સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ. સ્વામીશ્રી, પૂ. પૂર્ણસ્વરૂપ સ્વામી, પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો-ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

હરિપુરામાં યોજાયેલ કથા-પારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

અમરેલી તાલુકાના હરિપુરા ગામખાતે યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૯-૪-૦૭ થી તા. ૨૪-૪-૦૭ સુધી ગઢપુરના પા. ભાણજી ભગત અને પા. રમેશ ભગતના માર્ગદર્શન પ્રમાણે ભવ્ય કથા-

પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભાણ નિવાસી પૂ. અ.નિ. સ્વામી શ્રી પુરાણી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય પૂ. સ્વામી શ્રી શાંતિપ્રસાદદાસજીના વ્યાસાસને બિરાજ પોતાની સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે તા. ૨૩-૪-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. તેઓશ્રીનું ગામના ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમશ્રી સ્વામિનારાયણ મંદિરમાં

વિરાજમાન અર્ચા સ્વરૂપ ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સંતો-ભક્તોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

સનાળામાં યોજાયેલ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

બગસરા તાલુકાના સનાળા ખાતે યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૯-૪-૦૭ થી તા. ૨૩-૪-૦૭ સુધી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી નિષ્કામસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના

મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ધનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

તા. ૨૩-૪-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. સૌપ્રથમશ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન અર્ચા

સ્વરૂપ ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સંતો-ભક્તોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.



બરવાળા (બાવીસી)માં યોજાયેલ રાત્રિ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

બરવાળા બાવીસી ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૨૩-૪-૦૭ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાકે

ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં સનાળાને યોજાયેલ કથાપારાયણની પૂર્ણાહુતિ કરીને પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. નિષ્કામસ્વામી - સરધાર વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

રામોદમાં યોજાયેલ દેવોનો વાર્ષિક પાટોત્સવ

ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ

મંદિર - રામોદમાં વિરાજમાન દેવોના વાર્ષિક પાટોત્સવનું તા. ૧૯-૪-૦૭ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાટોત્સવ પ્રસંગે સરધારથી પૂ. આનંદસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. પ્રેમવલ્લભદાસજી સ્વામી પધારી રાત્રિ સત્સંગ

કથા-વાર્તાનો લાભ ભક્તજનોને આપ્યો હતો.

સવારે ૭.૦૦ કલાકે ઠાકોરજીનું પોડ્શોપચારો વડે પૂજન કરી કેસર યુક્ત પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે ઠાકોરજીને અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

સરધાર શ્રી સ્વા.મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પ

ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી અને સમસ્ત સરધાર ગામજનો દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સમાહ

પારાયણના ઉપક્રમે તા. ૧૯-૪-૦૭ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કિસાન સીમેન્ટ અને જયદિપ કોટનના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૮૩૫ જેટલા દર્દીઓનું નિદાન થયું હતું. આ પ્રસંગે પૂ. સંતો તથા શ્રી સ્વા.મંદિર

હોસ્પીટલના પ્રમુખ અને રાજકોટ-લોધીકા સંઘના પ્રમુખ શ્રી નિતીનભાઈ ઢાંકેયા, સરપંચ શ્રી દિલિપભાઈ ઢાંકેયા, ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયા, રાજકોટ પીપલ્સ બેંકના ચેરમેન શ્રી શામજીભાઈ ખુંટ, જળકાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુઢાગીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તલગાજરડામાં યોજાયેલ વાર્ષિક પાટોત્સવ ઉપક્રમે શ્રીમદ્ સત્સંગિજીવન પારાયણ

મહુવા તાલુકાના તલગાજરડા ખાતે યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૨૩-૪-૦૭ થી તા. ૧-૫-૦૭ સુધી

અમરેલી નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી ભક્તિસંભવદાસજીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી ગોપાલમુનિદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન નવાલ પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમિયાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા

ધનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અમરેલી નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી ભક્તિસંભવદાસજી આદિક સંતો પધારી ભક્તજનોને કથા-વાર્તાનો લાભ આપ્યો હતો.

કુંભારીયા-તાવેડામાં યોજાયેલ દેવોનો વાર્ષિક પાટોત્સવ

ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી ગત વર્ષ કુંભારીયા તથા તાવેડા ખાતે પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે થયેલ મૂર્તિ પ્રતિષ્ઠા

મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમપાટોત્સવનું તા. ૨૩-૪-૦૭ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાટોત્સવ પ્રસંગે સરધારથી પૂ. જ્ઞાનવલ્લભ સ્વામી તથા પૂ. પતિતપાવન સ્વામી પધારી સત્સંગ કથા-વાર્તાનો લાભ

ભક્તજનોને આપ્યો હતો.

બંને સ્થળો ઠાકોરજીનું પોડ્શોપચારો વડે પૂજન કરી કેસર યુક્ત પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે ઠાકોરજીને અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

શ્રીજીમંદિર - સુરતના છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે યોજાયેલ કથા-પારાયણમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી

સુરતને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૨૫-૪-૦૭ થી તા. ૧-૫-૦૭ સુધી શ્રીજીમંદિરના છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે અને પુણા મંદિરના લાભાર્થે ખોપાળા નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજીના કૃપાપાત્ર શિષ્ય પૂ. સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ

‘શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ઘનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તા. ૨૫-૪-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પોથીયાત્રામાં પધાર્યા હતા. સૌપ્રથમ તેઓશ્રીનું સ્વાગત ભવ્ય શોભાયાત્રા સુરત શહેરના મુખ્ય

રાજમાર્ગ ઉપર પસાર થઈને કથાસ્થળ સુધી કાઢી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓનું પૂ. સંતો તેમજ યજમાનશ્રી દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સદ્. સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

પલોલમાં યોજાયેલ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મહોત્સવ

તારાપુર તાલુકાના પલોલ ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી અને સ્વામી નિત્યસ્વરૂપદાસજી ગુરુ પૂ. વકીલ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ મંદિર - રૂણજના લાભાર્થે ભવ્ય શ્રી સ્વામિનારાયણ મહોત્સવનું તા. ૨૫-૪-૦૭ થી તા. ૧-૫-૦૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વરજાંગ જાળિયા નિવાસી પૂ. પુરાણી સ્વામીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ ‘શ્રીમદ્ સત્સંગિજીવન કથા

પારાયણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ઘનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તા. ૨૬-૪-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પોથીયાત્રામાં પધાર્યા હતા. તેઓશ્રીનું સ્વાગત ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગ ઉપર પસાર થઈને કથાસ્થળ સુધી કાઢી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓનું પૂ. સંતો તેમજ યજમાનશ્રી દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ.

સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી.

તા. ૧-૫-૦૭ના રોજ ફરીને પ.પૂ. લાલજી મહારાજશ્રી આ મહોત્સવ પ્રસંગે યોજાયેલ હરિયાગ યજ્ઞમાં પધારી યજ્ઞકુંડમાં શ્રીફળ બીડું હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી. ત્યારબાદ સભામંચમાં પધારીને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે સરધારથી પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. એસ.પી., સ્વામી, પૂ. ભક્તિસંભવ સ્વામી, તથા પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી પધાર્યા હતા.

આજે જ જુઓ અને તપાસો. આપનું લવાજમ ક્યારે પૂરું થાય છે ?

હાલા ભક્તજનો! ‘શ્રી સ્વામિનારાયણ ચિંતન’ના દરેક અંકમાં સરનામાના લેબલ (મેઈલ બોક્સ) ઉપર આપનો ગ્રાહક નંબર અને આપનું લવાજમપૂરું થવાના મહિના-વર્ષની માહિતી આપવામાં આવે છે. માટે આપના ‘શ્રી સ્વામિનારાયણ ચિંતન’ના કવર પર સરનામાનું લેબલ હંમેશા તપાસતા રહો, અને લવાજમપૂરું થાય તે પહેલાં જ આશરે ૪૦ દિવસ પહેલાં આપના નજીકના વિસ્તારમાં ‘ચિંતન’ અંકના ગ્રાહક નોંધણી કરતા કાર્યકર પાસે આપનો ગ્રાહક નંબર આપીને લવાજમભરવું, જેથી ‘શ્રી સ્વામિનારાયણ ચિંતન’નો એક પાંચ અંક ચૂકી ન જવાય. અને હા, દર વર્ષે લવાજમભરવાનું યાદ રાખવું પરંતુ તે કરતાં પાંચ વર્ષનું અથવા આજીવન લવાજમએકસાથે પણ ભરી શકાય છે.

સરનામાના લેબલના નીચે આપેલા નમૂના પરથી આપ આપના અંકનું લેબલ તપાસતા રહો અને નવું લવાજમભરવાની પ્રક્રિયા સમયસર કરતા રહો...

મુ. રાજકોટ નંબર : 1
ગઢવી પ્રફુલભાઈ જબરદાનભાઈ
૧૦ ‘રામપ્રતાપ’ ગીતાનગર મેઈન રોડ, રાજકોટ
પીન - ૩૬૦૦૦૨ પોસ્ટીંગ તારીખ : ૨૦-૫-૦૭
લવાજમ પુરું : 10/20/07

**આ છે આપના
અંકના લવાજમ
સમાપ્તિની તારીખ**



વાંશીયાળી ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૨૩-૪-૦૭ થી તા. ૨૯-૪-૦૭ સુધી ગઢપુરના બ્રહ્મચારી પૂ. સ્વામી શ્રી ચંદ્રપ્રકાશાનંદજીના માર્ગદર્શન પ્રમાણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગઢપુર મંદિર કો. સ્વામી શ્રી ધનશ્યામવદલભદ્રાસાજીના વ્યાસાસાને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ

ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ધનશ્યામ જન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

શોભાયાત્રા

આ મહોત્સવ તા. ૨૮-૪-૦૭ના રોજ બપોરે ૩.૩૦ વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા. ગામના ભાગોળથી પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને કથાસ્થળે શોભાયાત્રા વિરામપામી હતી.

ત્યારબાદ સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું

ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ. એસ.પી. સ્વામી, તથા પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો-ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

મૂર્તિ પ્રતિષ્ઠા

તા. ૨૯-૪-૦૭ના રોજ સવારે શુભ મૂહુર્તમાં નૂતન મંદિરમાં શુભ મુહુર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

ચાંદગઢમાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

અમરેલી જીલ્લાના ચાંદગઢ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૯-૪-૦૭ના રોજ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તા. ૨૯-૪-૦૭ના રોજ સવારે ૯.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

પધાર્યા હતા. ગામના ભાગોળથી મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તથા પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને નૂતન મંદિરે વિરામપામી હતી.

ત્યારબાદ નૂતન મંદિરમાં શુભ મુહુર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

ત્યારપછી સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. શુકમુનિ સ્વામી - અમરેલી, પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. નિષ્કામસ્વામી, વગેરે સંતો-ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

પીયાવામાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી અને ગઢપુરના અ.નિ. પૂ. સ્વામી શ્રી જયપ્રકાશદાસજીના અધ્યાગ પરિશ્રમથી તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૨૪-૪-૦૭ થી તા. ૩૦-૪-૦૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના વ્યાસાસને સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ધનશ્યામ

જન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

શોભાયાત્રા

આ મહોત્સવ પ્રસંગે તા. ૨૯-૪-૦૭ના રોજ બપોરે ૩.૩૦ કલાકે વડતાલથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા.

સૌપ્રથમ સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના કૃષિમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુગસમા, પ્રદેશ પ્રમુખ શ્રી પુરુષોત્તમરૂપાલા, ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી તથા અન્ય રાજકીય મહાનુભાવો ઉપસ્થિત

રહ્યા હતા. તેઓશ્રી પણ પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પુરુષમાળા અર્પણ કરીને સ્વાગતપૂર્ણ કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

મૂર્તિ પ્રતિષ્ઠા

તા. ૩૦-૪-૦૭ના રોજ સવારે શુભ મૂહુર્તમાં નૂતન મંદિરમાં શુભ મુહુર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમઆરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.



કોવાયામાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજુલા તાલુકાના કોવાયા ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૩૦-૪-૦૯ના રોજ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તા. ૩૦-૪-૦૯ના રોજ સવારે ૮.૦૦ કલાકે પીયાવાથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

પધાર્યા હતા. ગામના ભાગોળથી મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ તથા પ.પૂ. લાલજી મહારાજશ્રી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા આખામાં ફરીને નૂતન મંદિરે વિરામપામી હતી.

ત્યારબાદ નૂતન મંદિરમાં શુભ મુહૂર્તમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમ આરતી ઉતારી ભક્તજનોને માટે મંદિરના દ્વાર ખુલ્લા કર્યા હતા.

ત્યારપછી સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું. યજમાનશ્રીઓ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. જ્ઞાન સ્વામી - સરધાર, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો-ભક્તોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અંતમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને પોતાની દિવ્યમય અમૃતવાણી અને સમીપ દર્શનનો લાભ આપી ધન્યભાગી બનાવ્યા હતા.

જુની હળિયાદમાં યોજાયેલ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

ભગસરા તાલુકાના જુની હળિયાદ ખાતે યોજાયેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૩-૫-૦૭ થી તા. ૭-૫-૦૭ સુધી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી નિષ્કામસ્વરૂપદાસજીના વ્યાસાસને

સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમ્યાન ભક્તજનોના ખૂબજ ઉત્સાહ સાથે પૂ. વક્તાશ્રી દ્વારા ઘનશ્યામજન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, અન્નકૂટોત્સવ, રાસોત્સવ વગેરે ઉત્સવો પોતાની ભાવવાહી સુમધુર શૈલીમાં ગીત-સંગીતની સાથે ઉજવવામાં આવ્યા હતા.

તા. ૬-૫-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. સૌપ્રથમશ્રી

સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન અર્ચા સ્વરૂપ ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સંતો-ભક્તોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

શેડુભારમાં યોજાયેલ પંચામૃત મહોત્સવમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

અમરેલી તાલુકાના શેડુભારને આંગણે સેવા મંડળ દ્વારા યોજાયેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા મકાન ખાતમુહૂર્ત અને કોમ્પ્યુટર લેખ, પ્રયોગશાળા, પંચયટી બાળ ક્રિડાંગણ, એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણ પ્રસંગે પંચામૃત મહોત્સવમાં તા. ૬-૫-૦૭ના રોજ વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા.

સૌપ્રથમઆયોજક સમિતિ દ્વારા પ.પૂ.

લાલજી મહારાજશ્રીનું પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ.પૂ. લાલજી મહારાજશ્રી દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળા મકાનનું ખાતમુહૂર્ત ભૂદેવો વેદગાન મંત્રો સાથે કરવામાં આવ્યું હતું.

ત્યારપછી સભામંચમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ

ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે સરધારથી પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, અમરેલીથી પૂ. સ્વામી શ્રી ભક્તિસંભવદાસજી, ગઢપુરથી પૂ. એસ.પી. સ્વામી, પૂ. કોઠારી સ્વામી, વડતાલથી પૂ. ઘનશ્યામસ્વામી વગેરે સંતો પધારી શોભાની અભિવૃદ્ધિ કરી હતી.

નાના માચીયાળામાં યોજાયેલ રાત્રિ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૬-૫-૦૭ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાકે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં શેડુભાર ખાતે યોજાયેલ પંચામૃત મહોત્સવની પૂર્ણાહુતિ કરીને પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. તેઓશ્રીનું ગામના ભાગોળથી મંદિર સુધી શોભાયાત્રા કાઢીને ભવ્ય ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌપ્રથમમંદિરમાં વિરાજમાન દેવોનું પૂજનવિધિ સાથે શુદ્ધિકરણ કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સભાસ્થાનમાં તેઓનું

પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પૂ. ભક્તિસંભવદાસજી સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.



ચરોતર પ્રદેશના ડભાસા ગામમાં ઉજવાયેલ નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

ચરોતર પ્રદેશના ડભાસા ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી

મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૪-૫-૦૯ના રોજ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તા. ૪-૫-૦૯ના રોજ શુભ મુહૂર્તમુદ્દેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા

સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વડતાલથી પૂ. ધનશ્યામસ્વામી, પૂ. ધર્મવલ્લભ સ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો પધારી સત્સંગ કથા-વાર્તાનો લાભ આપ્યો હતો.

પારીખામાં યોજાયેલ શ્રી કષ્ટભંજન દેવનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ

ચરોતર પ્રદેશના પારીખા ગામખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર પારીખામાં સદ્.

ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદ્. ઉપેન્દ્રાનંદ સ્વામી દ્વારા સ્થાપિત શ્રી કષ્ટભંજનદેવની આવતા વર્ષે ૧૫૦ વર્ષ પુરા થતાં હોય તે પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવ મૂર્તિનું વિસર્જન કરીને કલરકામકરવામાં આવ્યું હતું.

ફરીને મૂર્તિ તૈયાર થતાં પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ તા. ૪-૫-૦૯ના રોજ રાખવામાં

આવ્યો હતો.

આ પ્રસંગે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વડતાલથી પૂ. ધનશ્યામસ્વામી, પૂ. ધર્મવલ્લભ સ્વામી - રઘુવીરવાડી વગેરે સંતો પધારી સત્સંગ કથા-વાર્તાનો લાભ આપ્યો હતો.

ચણાકા ગામને આંગણે યોજાયેલ નૂતન મંદિરનો ખાતમુહૂર્તવિધિ મહોત્સવ

જુનાગઢ જીલ્લાના ચણાકા ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિરનો

ખાતમુહૂર્તવિધિ મહોત્સવ તા. ૮-૫-૦૯ના રોજ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તા. ૮-૫-૦૯ના રોજ રાત્રે ૮.૦૦ કલાકે સરધાર નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સંતમંડળ સાથે પધારી સત્સંગ કથા-વાર્તાનો લાભ આપ્યો હતો.

તા. ૮-૫-૦૯ના રોજ સવારે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નૂતન મંદિરનું ખાતમુહૂર્ત પ.પૂ. લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. સ્વામીશ્રીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ નૂતન મંદિરનું બાંધકામ પૂ. સ્વામીશ્રીના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવશે.

ભાવનગરમાં યોજાયેલ દેવોનો વાર્ષિક પાટોત્સવ

ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી ગત વર્ષ ભાવનગર ખાતે સ્વામિનારાયણનગર વિસ્તારમાં પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે થયેલ મૂર્તિ પ્રતિષ્ઠા

મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવનું તા. ૧૦-૫-૦૯ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાટોત્સવ પ્રસંગે તા. ૮-૫-૦૯ના રોજ રાત્રે ૮.૦૦ કલાકે સરધાર નિવાસી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સંતમંડળ સાથે પધારી સત્સંગ કથા-વાર્તાનો લાભ ભક્તજનોને

આપ્યો હતો.

સવારે ઠાકોરજીનું મહાપૂજાની સાથે ખોડશોપચારો વડે પૂજન કરી કેસર યુક્ત પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે ઠાકોરજીને અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.

વરજોગ જાળિયામાં યોજાયેલ નૂતન સભામંડપનો ઉદ્ઘાટન મહોત્સવ

ઉપલેટા તાલુકાના શ્રીજીમહારાજના ચરણથી પવિત્ર બનેલ વરજોગ જાળિયા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પૂ. પુરાણી સ્વામી શ્રી શ્રાહરિદાસજીના માર્ગદર્શન પ્રમાણે તા. ૧૨-૫-૦૯ના રોજ નૂતન સભામંડપનો શ્રીહરિયાગ યજ્ઞની સાથે ઉદ્ઘાટન મહોત્સવ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તા. ૧૧-૫-૦૯ના રાત્રે ૮.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી

સંતમંડળ સાથે પધાર્યા હતા. સૌપ્રથમ તેઓશ્રીનું સભાસ્થાનમાં પૂ. વડીલ સંતો તેમજ યજ્ઞમાનશ્રી દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરધારશ્રી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. ધનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી - અમરેલી, પૂ. વડીલ સ્વામી, પૂ. સર્વમંગલ સ્વામી - વડતાલ વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

તા. ૧૨-૫-૦૯ના રોજ સવારે ૭.૦૦ કલાકે નૂતન સભામંડપમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીએ ભુદેવોના વેદમંત્રોના ગાન સાથે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિની પ્રથમ આરતી ઉતારી ભક્તજનોને માટે સભામંડપના દ્વાર ખુલ્લા કર્યા હતા.

વરજોગ જાળિયામાં ઉદ્ઘાટન મહોત્સવ સમાપ્ત કરીને મોજડા ગામજવા વિદાય થયા હતા.

મોજીડામાં યોજાયેલ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

ઉપલેટા તાલુકાના મોજીડા ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૨-૫-૦૭ના રોજ સવારે ૮.૩૦ કલાકે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ સભામાં વરજાનંગ જાળિયામાં

યોજાયેલ ઉદ્ઘાટન મહોત્સવમી પૂર્ણાહતિ કરીને પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. સૌપ્રથમગામના ભાગોળથી મંદિર સુધી શોભાયાત્રા કાઢીને પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારપછી સભાસ્થાનમાં તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. પુરાણી સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

આખા ગામમાં સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

જે ગામની ઓઝત નદીને કાંઠે છ-છ મહિના સુધી યજ્ઞ કર્યો હતો તેમજ અનેક લીલાઓ કરીને એવા આખા ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૨-૫-૦૭ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં

આવ્યું હતું.

આ સત્સંગ સભામાં પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. સૌપ્રથમગામના ભાગોળથી મંદિર સુધી શોભાયાત્રા કાઢીને પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારપછી સભાસ્થાનમાં તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા

પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. પુરાણી સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

કેશોદમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

કેશોદ ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૨-૫-૦૭ના રોજ બપોરે ૨.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સંતમંડળ સાથે

પધાર્યા હતા. સૌપ્રથમમંદિરમાં બિરાજમાન ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ કેશોદ અગ્રગણ્ય ભક્તો દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંતમાં સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. પુરાણી સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ.

શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

ગળોદરગામમાં સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

માળીયા (હાટીના) તાલુકાના ગળોદર ગામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૨-૫-૦૭ના રોજ બપોરે ૩.૩૦ કલાકે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું

હતું.

આ સત્સંગ સભામાં પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. સૌપ્રથમગામના ભાગોળથી મંદિર સુધી શોભાયાત્રા કાઢીને પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારપછી સભાસ્થાનમાં તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા

પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. પુરાણી સ્વામી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.



માળીયા (હાટિના)માં સત્સંગ અભ્યુદય મહોત્સવમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

સોરઠ પ્રદેશના માળીયા (હાટિના) ગામનો આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૨-૫-૦૭ના રોજ સાંજે ૫.૦૦ કલાકે ભવ્ય સત્સંગ અભ્યુદય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્સંગ અભ્યુદય સભામાં પ.પૂ. લાલજી મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. સૌપ્રથમગામના ભાગોળથી

સભાસ્થાન સુધી ભવ્ય શોભાયાત્રા કાઢીને પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આજુબાજુના વિસ્તારના ભક્તજનો જોડાયા હતા. શોભાયાત્રાની સમાપ્તિ પછી સભાસ્થાનમાં તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાંપરડાથી પૂ. મુક્તાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીને પુષ્પમાળા પહેરાવી આવકાર્યા હતા.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. પુરાણી સ્વામી, પૂ.

ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

સભા સમાપ્તિ બાદ શ્રી સ્વામિનારાયણ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી.

વંડામાં યોજાયેલ કથા-પારાયણ પ્રસંગે પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

સાવરકુંડલા તાલુકાના વંડાને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તા. ૧૩-૫-૦૭ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વડતાલથી પ.પૂ. લાલજી મહારાજશ્રી પધાર્યા હતા. સૌપ્રથમ

શ્રી સ્વામિનારાયણ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓશ્રીનું સ્વાગત ભવ્ય શોભાયાત્રા ગામના ભાગોળેથી કથાસ્થળ સુધી કાઢી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરમાં વિરાજમાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓનું પૂ. સંતો તેમજ યજમાનશ્રી દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી, પૂ. કોઠારી - સ્વામી - ગઢપુર, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

સાવરકુંડલા તાલુકાના વિઘવિઘ ગામોમાં યોજાયેલ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી

સાવરકુંડલા તાલુકાના જેજાદ, ઠવી, વિરડી અને ભમોદ્રા વગેરે ગામોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તા. ૧૩-૫-૦૭ના રોજ ભવ્ય સત્સંગ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરેક સત્સંગ સભામાં પ.પૂ. લાલજી

મહારાજશ્રી સંતમંડળ સાથે પધાર્યા હતા. આ દરેક ગામોમાં સૌપ્રથમગામના ભાગોળથી મંદિર સુધી શોભાયાત્રા કાઢીને પ.પૂ. લાલજી મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર બિરાજનાન ઠાકોરજીની પ.પૂ. લાલજી મહારાજશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારપછી સભાસ્થાનમાં તેઓનું પૂ. સંતો-ભક્તો દ્વારા પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરધારથી પધારેલ પૂ. સદ્. સ્વામી શ્રી

નિત્યસ્વરૂપદાસજી, પૂ. ઘનશ્યામસ્વામી - રઘુવીરવાડી, પૂ. શુક સ્વામી-અમરેલી, વગેરે સંતોના પ્રાસંગિક ઉદ્બોધન પછી પ.પૂ. લાલજી મહારાજશ્રીએ સહુ ભક્તજનોને આશીર્વાદની અમૃતવર્ષા વરસાવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભક્તોએ પ.પૂ. લાલજી મહારાજશ્રીના સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો.

૪૮મા ગુજરાત સ્થાપના દિને 'આરપાર' દ્વારા સર્વે થયેલ પાવરલિસ્ટમાં સમાવેશ થયેલ ગઢપુરના પૂ. એસ.પી. સ્વામી (બોર્ડ સલાહકાર)ને હાર્દિક અભિનંદન...



સાચા અર્થમાં પાવરફુલ હોવું એટલે શક્તિ પ્રદર્શન કર્યા વગર સૌને પોતાની શક્તિનો અહેસાસ કરાવવો. ગુજરાતના પચીસ મહાશક્તિમાનોની કક્કાવાર યાદી. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહો કે અંગત માન્યતાઓને વચ્ચે લાવ્યા સિવાય તટસ્થ અભિપ્રાયો અને સો ટચની માહિતીનો આધાર લઈને 'આરપાર' દ્વારા બનાવવામાં આવેલ પાવરલિસ્ટ - ૨૦૦૭માં સર્વોપરી ઈજ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણકૃપાથી તેમજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી ગઢપુર ટેમ્પલ બોર્ડના સલાહકાર પૂ. એસ.પી. સ્વામીનું નામપણ ગુજરાતના મહાશક્તિમાન પચીસ વ્યક્તિઓના પાવરલિસ્ટમાં સમાવેશ થયેલ છે તે બદલ તેઓશ્રીને ભગવાન શ્રીહરિ વધુને વધુ સંપ્રદાયના સત્ય સિદ્ધાંતોને મજબુત બનાવવા શક્તિ આપે તેવી શ્રીહરિના પ્રાર્થના સહ હાર્દિક અભિનંદન...

લી. શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર વતી પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તથા દક્ષિણ વિભાગ સમસ્ત સત્સંગ સમાજ

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી અ.નિ. પ.ભ.શ્રી વલ્લભભાઈ પોપટભાઈ માલવીયાના સ્મૃતિમાં જેસીંગપરા-અમરેલીને આંગણે


શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ

-: પ્રારંભ :-
તા. ૧૮-૫-૦૭
અ.જેઠ સુદ - ૨

:: વક્તા ::
પૂ. સદ્. સ્વામી શ્રી ભક્તિસંભવદાસજી
વડતાલ (હાલ-અમરેલી) તથા
પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી વડતાલ (હાલ-સરધાર)

-: પૂર્ણાહુતિ :-
તા. ૨૪-૫-૦૭
અ.જેઠ સુદ - ૮

કથા સ્થળ :- જેસીંગપરા, શીતળા માતાના પ્લોટમાં, શીશુ મંદિરની બાજુમાં, અમરેલી મો. ૯૮૭૯૭ ૫૮૫૦૮



શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા પ્રસ્તુત
આજે જ આપના ઘરમાં વસાવો... નૂતન પ્રકાશનો...

હરિવર મારે હાથે જમાડું...

ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદસંતો દ્વારા રચિત થાળસંગ્રહ પદોને સાંભળતા જાણે આપણે પ્રત્યક્ષ શ્રીજીમહારાજને ભાવથી વિધવિધ વાનગી જમાડી રહ્યા છીએ તેવો ભાવ આપણા હૃદયસ્થ આ 'હરિવર મારે હાથે જમાડું'ને સાંભળતાં જ થઈ જાય તે રીતે પદોનું સંતોના સુમધુર કંઠે સંગીતમય મધુરગાન.



વાક્ષપના વૅણા...



પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સમસ્ત મુંબઈ પરાવિસ્તાર દ્વારા આયોજીત 'શ્રી સ્વામિનારાયણ મહોત્સવ'માં પધારેલ પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય અમૃતવાણી...

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી
પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય સંનિધિમાં

શ્રી સ્વામિનારાયણ મંદિર - ડોંબીવલી તથા બોરિવલીનો

॥ ભવ્ય તૃતીય પાટોત્સવ ॥

:: ડોંબીવલી પાટોત્સવ કાર્યક્રમ ::

સવારે ૧૧.૩૦ કલાકે

સત્સંગ સભા : સવારે ૧૨ થી ૧

:: મહોત્સવ તારીખ ::

૨૫-૬-૦૭

જેઠ સુદ - ૧૦ સોમવાર

:: બોરિવલી પાટોત્સવ કાર્યક્રમ ::

સવારે ૮.૦૦ કલાકે

સત્સંગ સભા : સવારે ૮.૩૦ થી ૧૦

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ
આજ્ઞાથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય સંનિધિમાં સમસ્ત મુંબઈ પરાવિસ્તાર
શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ આયોજીત થાણાને આંગણે ભવ્ય

॥ દ્વિમાસિક સત્સંગ સભા ॥

તારીખ :- ૨૫-૬-૦૭, જેઠ સુદ - ૧૦, સોમવાર. સમય : બપોરે ૪.૦૦ થી ૭.૦૦

સ્થળ :- 'કાંતિ વીસરયા હોલ' થાણા(વેસ્ટ) મો. ૮૮૨૦૧ ૪૦૪૮૮/૮૮, ૮૮૨૧૨ ૧૬૦૬૬

**શ્રીજીપ્રસાદિભૂત તીર્થધામ સરધારને આંગણે
દિપાવલીના શુભ અવસર ઉપર ઘનતેરશથી લાભપાંચમસુધી**

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ
પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદે બારમી

॥ શ્રી સ્વામિનારાયણ સત્સંગ છાવણી ॥

પ્રયોજક :- પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી - વડતાલ (હાલ - સરધાર)

સ્થળ :- 'શ્રી સ્વામિનારાયણ બાગ' શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર, ફો.નં. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧, મો. ૮૮૭૯૭૫૮૫૦૩

દર મહિનાના પહેલા રવિવારે સરધાર અને મહિનાના છેલ્લા શનિવારે રાજકોટમાં યોજાતી

:: અભયદાન સત્સંગ સભા ::

સરધાર :- તા. ૩-૬-૦૭, જેઠ વદ - ૨ (અધિક માસ), રવિવાર સવારે ૮ થી ૧૨

રાજકોટ :- તા. ૨૬-૫-૦૭, જેઠ સુદ - ૧૦ (અધિક માસ) શનિવાર, રાત્રે ૮ થી ૧૧

સંપર્ક :- મહેન્દ્રભાઈ પાટીયા મો. ૮૪૨૬૨ ૨૮૫૫૮, કરશનભાઈ ઢાંકેયા મો. ૮૪૨૬૭ ૮૧૧૭૮

શ્રી સ્વામિનારાયણ ચિંતન ❖ મે - ૨૦૦૭



૩૫

સરધારધામને આંગણે આગામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા

“ટુંક સમયમાં જ પ્રકાશિત થાય છે...”

સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી દ્વારા વિરચિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાન સમ્રાટ ગ્રંથ (મૂળ શ્લોક સહિત ગુજરાતી ભાષાંતર)



॥ શ્રીમદ્ સત્સંગિજીવન ॥

ઢાલા ભક્તજનો ! ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્વમુખે જે શાસ્ત્રને સર્વશાસ્ત્રમાં શિરમોડ શાસ્ત્રનું બિરૂદ આપી પ્રશંસા કરી છે તેવા શ્રીમદ્ સત્સંગિજીવન ગ્રંથને નંદસંતોના હસ્તલિખિત પ્રતના માધ્યમથી સર્વપ્રથમવાર સંસ્કૃતની સાથે સરળ ગુજરાતી ભાષામાં ખૂબ સુંદર રીતે પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ. ૧૦૮ ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ પૂ. સદ્. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા પ્રકાશિત કરવાનો નિર્ધાર કરેલો છે. જેનું શુદ્ધ અને વિષયવાર હેડીંગ, પેરેગ્રાફાદિ સહિત માટે જ વાંચવામાં સરળ અને શ્રવણગમ્ય ગુજરાતી અનુવાદ તથા મુક્ક સંશોધન સરધાર નિવાસી સ્વામી શ્રી આનંદસ્વરૂપદાસજી (વેદાંતાચાર્ય)એ કરેલ છે.

ફોરકલરમાં વિવિધ ચિત્રાવલીના આશરે ત્રીશેક પોઝ યુક્ત આ ગ્રંથ અંદાજે રૂ. ૪૫૦ ની મૂળ કિંમતે તૈયાર થશે. પરંતુ આમાં જે કોઈ હરિભક્તો તરફથી રૂ. ૧,૦૦૦ નું સૌજન્ય આપવામાં આવશે તેનું આ ગ્રંથમાં દાતાની નામાવલિમાં નામલખાશે. ઉપરાંત તેમને એક ગ્રંથ ભેટ કરવામાં આવશે. અને જેટલું સૌજન્ય પ્રાપ્ત થશે તેટલી ગ્રંથની કિંમત ઘટાડી નાનામાં નાના હરિભક્ત સુધી તેને પહોંચાડી ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગ. મધ્ય. ૫૮ માં સ્વમુખે કહેલ છે કે, અમારા સંપ્રદાયની પુષ્ટિ તો અમારા જન્મથી તિરોધાન સુધીના ચરિત્ર સભર શાસ્ત્રના માધ્યમથી થાય, પરંતુ અન્ય રીતે ન થાય. તો આ ગ્રંથના પ્રકાશન-માધ્યમથી સંપ્રદાયની પુષ્ટિ થાય અને હજારો ભક્તજનોને ભગવાન શ્રીહરિની ઓળખાણ થાય અને જીવાત્માની મુક્તિ થાય એવો જ શુભ હેતુ છે.

તો આ ગ્રંથમાં સેવા લખાવી પોતાની સંપત્તિનું સદ્વ્યય અને ગ્રંથલાભ પ્રાપ્ત કરવા માંગતા હોય તે ભક્તજનો શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધારના નામથી ચેક/ડ્રાફ્ટ કે રોકડ રકમમોકલી શકશે. જેની મંદિર તરફથી પાકી પહોંચ આપવામાં આવશે.

આ ગ્રંથમાં જે કોઈ વ્યક્તિ રૂ. ૧,૦૦૦ લખાવશે તેનું આ ગ્રંથમાં નામતેમજ પ્રકાશન બાદ એક સેટ ભેટ આપવામાં આવશે. રૂ. ૨,૦૦૦ લખાવશે તેને બે સેટ અને રૂ. ૫,૦૦૦ લખાવશે તેને પાંચ સેટ ભેટ આપવામાં આવશે. તેમઆગળ રકમપ્રમાણે સેટ ભેટ આપવાનું યથાયોગ્ય જાણી લેવું.

તા.ક. ઢાલા ભક્તજનો ! હાલમાં આ ગ્રંથનું પ્રિન્ટીંગ ચાલુ છે. જો આપને ઉપરોક્ત તકની લાભ લેવાની ઈચ્છા હોય તો વહેલી તકે તા. ૩૦-૬-૦૭ સુધીમાં આપનું નામલખાવવા વિનંતી. ગ્રંથનું છાપકામપૂર્ણ થયા પછી આ અવસર પ્રાપ્ત થશે નહિ તેની દરેકે નોંધ લેવી. આ ગ્રંથનું વિમોચન ગુરુપૂનમના (૩૦-૬-૦૭) દિવસે વડતાલમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવશે. માટે અગાઉ જેમણે નામલખાવ્યું છે તેમણે જો રકમભરવાની બાકી હોય તો ઉપરોક્ત તારીખ સુધીમાં રકમભરપાઈ કરી દેવી. જેથી કરી તેમનું નામ ગ્રંથમાં આવી શકે. જેની દરેકે સભ્યોએ નોંધ લેવી.

ખાસ નોંધ :- આ ગ્રંથમાં જે કોઈ સેવા લખાવવા માંગતા હોય તેમણે સરધાર મંદિર અથવા પૂ. સંતોશ્રીનો સંપર્ક કરવા વિનંતી. ફો. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧, મો. ૯૮૭૯૭ ૫૮૫૦૩





સાલેયા




ખસ



વાંશીયાળી



ચાંદગઢ



નાના મુંજ્યાસર

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ સહ આજ્ઞાથી પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની દિવ્ય સંનિધિમાં ઉજવાયેલ વિવિધ ગામોમાં ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો...



પીયાવા



ડોવાયા



વરબાંગ જાળિયા

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વા. મંદિર - સરધારનું મુખપત્ર

શ્રી સ્વામિનારાયણ ચિંતન

મે - ૨૦૦૭



વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી ઉજવાયેલ
નાના મુંજ્યાસર તથા પીયાવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

૧. નાના મુંજ્યાસરમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારેલ પ.પૂ. લાલજી મહારાજશ્રીની નીકળેલ ભવ્ય શોભાયાત્રા. ૨. નાના મુંજ્યાસરમાં સભામંચમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૩. પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય અમૃતવચનોને માણતા ભક્તજનો - નાના મુંજ્યાસર. ૪. નાના મુંજ્યાસરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાનશ્રીને આશીર્વાદ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૫. નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર - નાના મુંજ્યાસર. ૬/૭. પીયાવામાં પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં નીકળેલ વિશાળ શોભાયાત્રા. ૮. સભામંચમાં પધારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી - પીયાવા. ૯. પૂ. સ્વામીશ્રીને આશીર્વાદનો ધાર પહેરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૦. ગુજરાત રાજ્ય સરકારના કૃષિમંત્રી માન. શ્રી ભૂપેન્દ્રસિંહ યુગસમાને આવકારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૧. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ માન. શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને આશીર્વાદનો ધાર પહેરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. સાવરકુંડલા મતવિસ્તારના ધારાસભ્ય માન. શ્રી કાળુભાઈ વિરાણીને આશીર્વાદનો ધાર પહેરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.

શ્રી સ્વામિનારાયણ ચિંતન, મે-૨૦૦૭ (૪૦)



વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી ઉજવાયેલ
નાના મુંજયાસર તથા પીયાવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

૧. નાના મુંજયાસરમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્ય યજમાનશ્રીના નિવાસસ્થાને પોથીયાત્રાનું પૂજન કરતા પૂ. સ્વામીશ્રી તથા યજમાન પરીવાર.
૨. નાના મુંજયાસરમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલ ઠાકોરજીની નગરયાત્રા. ૩. નાના મુંજયાસરમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે યોજાયેલ કથા-પારાયણ અંતર્ગત ઘનશ્યામજન્મોત્સવની આરતી ઉતારતા યજમાનશ્રીઓ. ૪. નાના મુંજયાસરમાં નૂતન મંદિરમાં કળશની સ્થાપના કરતા પૂ. સ્વામીશ્રી તથા યજમાનો. ૫. નાના મુંજયાસરમાં નૂતન મંદિરમાં દેવોની વેદોક્તવિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૬. પીયાવા ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે યોજાયેલ કથા-પારાયણ અંતર્ગત નીકળેલ ભવ્ય પોથીયાત્રા. ૭. પીયાવા ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે યોજાયેલ કથા-પારાયણ અંતર્ગત ઘનશ્યામજન્મોત્સવની ઉજવણી કરતા ઉત્સાહી યુવાનો. ૮. પીયાવામાં કથા-પારાયણ અંતર્ગત ગાદી પટ્ટાભિષેક મહોત્સવ નિમિત્તે ઠાકોરજીનો અભિષેક કરતા પૂ. સંતો તથા યજમાનો. ૯. પીયાવામાં ભક્તજનોને કથા-પારાયણનું રસપાન કરાવતા પૂ. સ્વામીશ્રી. ૧૦. પીયાવામાં ભક્તજનો ઉપર અમીવર્ષા વરસાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૧. પીયાવામાં રાત્રિ સત્સંગ સભામાં કીર્તન-ભક્તિનો લાભ લેતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. પીયાવામાં મંદિરમાં દેવોની વેદોક્તવિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.

શ્રી સ્વામિનારાયણ ચિંતન, મે-૨૦૦૭ (૩૯)



પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીર દર્શન

૧. ખાખરીયા ગામમાં યોજાયેલ કથા-પારાયણમાં દર્શન આપવા પધારેલ પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૨. ખસ ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલ શોભાયાત્રામાં વિરાજમાન પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૩. ખસ ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સભામાં અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૪. ખસ ગામમાં નૂતન મંદિર દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૫. સાલૈયા ગામમાં શોભાયાત્રામાં દર્શન આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૬. સાલૈયા ગામમાં ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાનશ્રીને સ્મૃતિચિહ્ન આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૭. સાલૈયા ગામમાં નૂતન મંદિર દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૮. સનાળા ગામમાં યોજાયેલ કથા-પારાયણમાં સભામાં દર્શન આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૯. બરવાળા બાવીશીમાં રાત્રિ સત્સંગ સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૦. સુરતમાં શ્રીજીમંદિરના છઠ્ઠા પાટોત્સવ ઉપક્રમે યોજાયેલ કથા-પારાયણ પ્રસંગે પોથીયાત્રામાં જોડાયેલ વિશાળ હરિભક્ત સમુદાય. ૧૧. પોથીયાત્રામાં દર્શન આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. પોથીજીનું પૂજન કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.

શ્રી સ્વામિનારાયણ ચિંતન, મે-૨૦૦૭ (૨)



**પ.પૂ. ઘ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના
શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીર દર્શન**

૧. આખા ગામમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી પધરામણી પ્રસંગે નીકળેલ ભવ્ય શોભાયાત્રા. ૨. આખા શ્રી સ્વા. મંદિરમાં અર્ચાસ્વરૂપ દેવોની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૩. આખા ગામમાં પોતાની અમૃતવર્ષાથી ભક્તજનો ભીજવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૪. કેશોદમાં શ્રી સ્વા.મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૫. કેશોદમાં ભક્તજનોને રૂડા આશીર્વાદ વરસાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૬. ગળોદરમાં શ્રી સ્વા.મંદિરમાં ઠાકોરજીના અર્ચા સ્વરૂપની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૭. ગળોદરમાં ભક્તસમુદાયને દિવ્ય ઉપદેશાત્મક અમૃતવાણીનું રસપાન કરાવતા કરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૮. માળીયા હાટિનામાં યોજાયેલ સત્સંગ અભ્યુદય મહોત્સવ પ્રસંગે પધારેલ શહેર મુખ્ય માર્ગ ઉપર પ.પૂ. લાલજી મહારાજશ્રીની નીકળેલ ભવ્ય શોભાયાત્રા. ૯. પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય અમૃતવચનોનું રસપાન કરતા સોરઠ સત્સંગ સમુદાય. ૧૦. માળીયામાં પ્રાસંગિક ઉદ્બોધન આપતા પૂ. સ્વામીશ્રી તથા સાથે પૂ. મુક્તાનંદજી બાપુ - ચાંપરડા. ૧૧. પોતાની પ્રેમાળ અને કરુણા સભર શૈલીમાં ભક્તસમુદાયને આશીર્વાદ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. કેશોદ શ્રી સ્વા. મંદિરમાં અર્ચાસ્વરૂપ દેવોની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



પ.પૂ. ઘ.દુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીર દર્શન

૧. જુની હળિયાદ ગામમાં યોજાયેલ કથા-પારાયણમાં પધારેલ પ.પૂ. લાલજી મહારાજશ્રીની નીકળેલ સ્વાગત શોભાયાત્રા. ૨. જુની હળિયાદ ગામમાં શ્રી સ્વા. મંદિરમાં બિરાજમાન ઠાકોરજીની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૩. કથાના વક્તા પૂ. નિષ્કામસ્વામીને આશીર્વાદનો હાર પહેરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૪. જુની હળિયાદમાં કથા-પારાયણ અંતર્ગત ગાદિ પટ્ટાભિષેક મહોત્સવમાં ઠાકોરજીનો અભિષેક કરતા પૂ. સ્વામીશ્રી. ૫. શેડુભાર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૬. શેડુભારમાં ઉચ્ચરત્તર માધ્યમિક શાળાના મકાનું ખાતમુહૂર્ત કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૭. સરધારમાં અભયદાન માસિક સત્સંગ સભામાં કથા-વાર્તાનો લાભ આપતા પૂ. સ્વામીશ્રી. ૮. ચણાકા ગામમાં પ.પૂ. લાલજી મહારાજશ્રી વતી નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરતા પૂ. સ્વામીશ્રી. ૯. વરજાંગ જાળિયામાં નૂતન સભામંડપના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ પ.પૂ. લાલજી મહારાજશ્રીની અમૃતવાણી લાભ લેતા ભક્તજનો. ૧૦. નૂતન સભામંડપમાં બિરાજમાન ઠાકોરજીના અયાંસ્વરૂપની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૧. ઉપલેટા તાલુકાના મોજડા ગામમાં શ્રી સ્વા. મંદિરમાં બિરાજમાન ઠાકોરજીની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. મોજડા ગામમાં સત્સંગ સભામાં ભક્તજનો પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



**પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના
શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીર દર્શન**

૧. તારાપુર તાલુકાના પલોલ ગામમાં શ્રી સ્વાનારાયણ મહોત્સવ પ્રસંગે પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સંત્રિધિમાં નીકળેલ ભવ્ય શોભાયાત્રા. ૨. શ્રી સ્વા. મહોત્સવમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પૂજન કરતા આયોજક પૂ. વકીલ સ્વામી. ૩. શ્રી સ્વા. મહોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રીહરિયાગ યજ્ઞમાં આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૪. શ્રી સ્વા. મહોત્સવમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીને સોળચિહ્ન યુક્ત ચરણારવિંદ અર્પણ કરતા આયોજક પૂ. વકીલ સ્વામી. ૫. વાંશીયાળી ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલ શોભાયાત્રા. ૬. વાંશીયાળીમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરતા ગઢપુરનાં પૂ. કોઠારી સ્વામી. ૭. વાંશીયાળી ગામમાં સભામાં દર્શન-અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૮. વાંશીયાળીમાં રાત્રિ સત્સંગ સભામાં કીર્તન-ભક્તિનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૯/૧૦. ચાંદગઢમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલ પ.પૂ. લાલજી મહારાજશ્રીના દર્શન-અમૃતવાણીનો લાભ લેતા હરિભક્તો. ૧૧. કોવાયા ગામમાં યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સભામાં અમૃતવાણીનો લાભ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. કોવાયા ગામમાં ચરણારવિંદ ડેરીનું પૂજન કરતા પ.પૂ. લાલજી મહારાજશ્રી.



પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદ સહ આજ્ઞાથી યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તસ્વીર દર્શન

૧. વંડા ગામમાં શ્રી સ્વા. મંદિરમાં બિરાજમાન ઠાકોરજીની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૨. વંડા ગામમાં સત્સંગ સભામાં આશીર્વાદ આપતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૩. પૂ. લાલજી મહારાજશ્રીની દિવ્ય અમૃતવાણીનો લાભ લેતો વિશાળ ભક્ત સમુદાય. ૪. જેજાદમાં પૂ. લાલજી મહારાજશ્રીની યોજાયેલ ભવ્ય શોભાયાત્રા. ૫. જેજાદ ગામમાં દિવ્ય અમૃતવચનોનું રસપાન કરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૬. ઠવી ગામમાં પ.પૂ. લાલજી મહારાજશ્રીની નીકળેલ સ્વાગત શોભાયાત્રા. ૭. ઠવી ગામમાં શ્રી સ્વા. મંદિરમાં અર્યાસ્વરૂપ દેવોની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૮. ઠવી ગામમાં ભક્તસમુદાયને દિવ્ય અમૃતવાણીનું રસપાન કરાવતા કરાવતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૯. વિરડી ગામમાં સત્સંગ સભા પ્રસંગે યોજાયેલ પ.પૂ. લાલજી મહારાજશ્રીની ભવ્ય શોભાયાત્રા. ૧૦. વિરડી મંદિરમાં અર્યાસ્વરૂપ દેવોની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૧. ભમોદ્રા ગામમાં અર્યાસ્વરૂપ દેવોની આરતી ઉતારતા પ.પૂ. લાલજી મહારાજશ્રી. ૧૨. પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય અમૃતવચનોનું રસપાન કરતા સોરઠ સત્સંગ સમુદાય.